

Super Visa/ Visitor to Canada Insurance

Best Mortgage Rates
1st and 2nd Mortgages
Life and Critical Illness Insurance
RRSP/RESP/INVESTMENTS

Ph.: 416-839-9645

Mukund Sheth
Financial Advisor
www.pyramidfinancial.ca
mukund@pyramidfinancial.ca

Serving at 2 locations
GTA East / GTA West ON LIC # 10530
Investment | Insurance | Mortgages

પરદેશમાં દેશની મહેક એટલે

સ્વદેશ

કેનેડાથી પ્રસિદ્ધ થતું સર્વોત્તમ ગુજરાતી સાપ્તાહિક SWADESH

FOR BUYING, SELLING & LEASING
Investment In Real Estate Can Make Your Future Better...

FOR SELLERS
Free Home Staging Consultation
Professional Photography & Virtual Tour
Attractive Advertising
Social Media Marketing
Customized Feature Sheet
Weekly Open House
Assist in Mortgage & Legal Services

FOR BUYERS
Team of Strong Mortgage Brokers
Team of Lawyers
Professional Home Inspectors
Step by Step Guidance Through out Buying Process

AMIT SHAH
Sales Representative
Dir: 647-995-5640
amitshah@realty.com

KOMAL SHAH
Sales Representative
Dir: 647-624-5640
komalshah@realty.com

Homekey236@gmail.com
Web: www.amitshah.ca

FRIDAY, 29 JULY, 2022 Vol. 19, No. 30 Pages 20 Tel: 416-996-7755, E-mail : info@swadesh.news Web : www.swadesh.news

શ્રીલંકા બાદ ઈરાકમાં પણ રાજકીય અંધાધૂંધી

ઈરાકમાં ભ્રષ્ટાચાર તથા કુશાસનથી પરેશાન જનતાએ સંસદ ભવનમાં અડીંગો જમાવ્યો, સંસદ ભવનમાં તોડફોડ

બગદાદ

છેલ્લા કેટલાક મહિનાઓથી એશિયા તથા યુરોપના કેટલાક પ્રમુખ દેશોમાં રાજકીય અસ્થિરતાનો દોર ચાલી રહ્યો છે. ત્યારે હવે આ યાદીમાં વધુ એક નામ પણ જોડાઈ ગયું છે. ઈરાકની રાજકીય સ્થિતિ પણ શ્રીલંકા જેવી બની રહી છે. તાજેતરમાં જ ભારતના પાડોશી દેશ શ્રીલંકામાં પણ ભારે હંગામા બાદ

ત્યાં નવા રાષ્ટ્રપતિ તથા વડાપ્રધાનની ચૂંટણી સંપન્ન કરાઈ હતી. બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને પણ પોતાના પદ પરથી રાજીનામું આપવું પડ્યું છે જ્યારે ઈટાલીના વડાપ્રધાને પણ પોતાનું પદ છોડવું પડ્યું છે. બુધવારે સેંકડો પ્રદર્શનકારીઓએ ઈરાકની રાજધાની બગદાદ ખાતે સંસદ ભવન પર કબજો જમાવ્યો હતો. જોકે ઈરાકમાં થઈ રહેલા પ્રદર્શનમાં જાન-માલનું કોઈ નુકસાન નથી નોંધાયું. ઈરાકમાં ભ્રષ્ટાચાર તથા કુશાસનથી પરેશાન જનતાએ સંસદ ભવનમાં કબજો જમાવ્યો હતો. આ ઉપરાંત તેમણે સંસદ ભવનમાં તોડફોડ પણ કરી હતી. પ્રદર્શનકારીઓએ ભ્રષ્ટાચાર અને કુશાસન વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા.



પ્રદર્શન પાછળ મૌલવી અલ-સદરના સમર્થકો

મૌલવી અલ-સદરના જૂથે ગત વર્ષે ઓક્ટોબર મહિનામાં ઈરાકની સામાન્ય ચૂંટણીમાં ૭૩ બેઠકો પર વિજય મેળવ્યો હતો. મૌલવી મુક્તદા અલ-સદરની પાર્ટી ઈરાકની સામાન્ય ચૂંટણીઓમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી. પરંતુ ઈરાકના રાષ્ટ્રપતિ બનવા માટે જરૂરી બહુમત ન મળવાના કારણે મુક્તદા અલ-સદરે સરકાર રચવાની વાતચીતથી અંતર જાળવ્યું હતું. તાજેતરના અહેવાલો પ્રમાણે ઈરાકમાં જે પ્રદર્શનો ચાલી રહ્યા છે તેના પાછળ મૌલવી અલ-સદરના સમર્થકોનો હાથ છે.

ABOWATH REAL ESTATE GROUP
VALUING RELATIONSHIPS OVER TRANSACTIONS EVERY DAY & TIME!

MAAZ ABOWATH
BROKER
416 893 4585

More Info on PAGE 2 વધુ માહિતી પાનું 2 પર

ABOWATH.COM

AIR CANADA Airline Tickets - Whole Sale Price
KLM Travel Insurance With Discount
AIR FRANCE Free Oath Commissioner Services
QATAR All Inclusive
SWISS Vacation Tour Packages
LUFTHANSA
BRITISH AIRWAYS

Fast + Best Services
VISA, PASSPORT, OCI
INTERSKY TRAVEL
514-389-7070 20 YEARS

સ્વતંત્રતા દિવસે ભારતમાં હુમલાની આશંકા

નવી દિલ્હી

ભારતમાં સ્વતંત્રતા દિવસના અવસર પર આતંકવાદી હુમલાની ગુમચર સૂચના છે. ખાસ વાત એ છે કે આ વખતે ત્રણ પ્રકારના ઈન્ટેલિજન્સ એલર્ટ છે, જેના આધારે સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. પ્રથમ ચેતવણી ડ્રોન દ્વારા હુમલો કરીને પાયમાલી સર્જવાની છે. ગુમચર એલર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે

આતંકવાદીઓ આ માટે પીઓકેમાં ડ્રોનને નિશાન બનાવવાની પ્રેક્ટિસ કરી રહ્યા છે. બીજી ચેતવણી એ પ્રકારે છે કે આતંકવાદીઓ મેટલ ડિટેક્ટરને પણ છેતરી શકે તે પ્રકારના અત્યાધુનિક સાધનોનો ઉપયોગ કરીને મોટા ગુનાને અજામ આપવા માંગે છે. ત્રીજા એલર્ટમાં, આતંકવાદીઓના એક જૂથનો ઉલ્લેખ PoKમાં કોટિલ(KOTIL) નામના લોન્ચિંગ પેડથી કરવામાં આવ્યો છે.

Residential
New Condos
Investments
Commercial

Zakir Patel
Broker

Cell: 416-561-7973
Office : 416-287-2222

RE/MAX COMMUNITY
Realty Inc., Brokerage

Independently Owned and Operated
1265, Morningside Ave. #203
Toronto, ON M1B 3V9
Email : patelzakir82@gmail.com

SUPER VISA INSURANCE

Get Full REFUND if visa is declined
Get partial refund if parents leave early*
*conditions apply.... Ask NOW for a free quote..

Sanjiv Puri
Insurance Broker
Ph.: 416-890-3232
Email: sanjivpuri@rogers.com

StarLife
Insurance & Investments Inc.
www.starlifeinsurance.ca

LIFE INSURANCE | FUNERAL INSURANCE | MORTGAGE INSURANCE | CRITICAL ILLNESS INSURANCE | DISABILITY INSURANCE
SUPER VISA INSURANCE | INSURANCE FOR VISITORS / NEW IMMIGRANTS | RESP | ESTATE PLANNING | RRSP | RETIREMENT PLANNING

Closing down sale!
Japanese Sarees, UK Sweaters and much more at attractive prices.

Upto **80% off**

• \$1 each Blouse Piece • 3 for \$100 Gold Print Jacquard Sarees. • 4 for \$100 Gold Print Sarees.
• 5 for \$100 UK Sweaters. • 10 for \$100 Printed Georgette Sarees. • 20 for \$100 Japanese Plain Suit Pcs and many more specials...

Biggest Sale Ever! Just in Time for the festive season!
Uma Sarees

6270 Côte des Neiges, Montreal
514-341-1394

છેલ્લા ૪૪ વર્ષથી ટોરન્ટોની સર્વ પ્રથમ ગુજરાતી ટ્રાવેલ એજન્સી. ૪૪ વર્ષથી ગુજરાતી પ્રજા અને ગુજરાતી ભાષા અમારી સક્ષમતા માટે યશભાગી છે. દિલથી આપની અમે ખૂબજ આભાર માનીએ છીએ. ક્વાઈ મુસાફરી ની ટીકીટ માટે અમારા ભાવ ટોરન્ટોમાં ખૂબજ આકર્ષક છે અજમાવી જુઓ... આપને આનંદ યશે.

Ashok Travels 416-977-9896 અશોક ટ્રાવેલ્સ ૪૧૬ ૯૭૭ ૯૮૯૬

Thank you for your continued support since last 44 years. We are glad to be your family travel agency and we feel proud to serve three generations with most competitive prices and excellent service.

www.ashoktravel.com
Ashok Travels Serving your travel needs in Canada since 1973
TICO # 1486999 238 Gerrard St. East, Suite 100 Toronto, ON M5A 2E8

ROMULUS IMMIGRATION RCIC
GLOBAL REACH CANADIAN CORE...

STUDY PERMITS, VISITOR VISA, PR & CITIZENSHIP APPLICATION

- Refugee Case and Appeal
- Super visa
- Student Visa
- Post Graduate
- P.R. Applications
- Humanitarian & Compassionate
- Work Permit (P.G.W.P)
- Citizen Applications
- Grounds Applications (H&C)
- Canadian Experience Class
- Work Permit applications
- Immigration Appeals
- Oath commissioner Services
- Family Sponsorships
- Express Entry
- Business visitor
- Provincial Nominee Application (PNP)

RCIC MOHIT AHUJA **RCIC ANKITA AHUJA**
info@romulusimmigration.com, 438-795-4690, 438- 836-7400

SS & LAWYERS LLP

- REAL ESTATE
- LITIGATION
- WILLS AND ESTATES
- AFFIDAVIT AND POWER OF ATTORNEY
- NOTARIZATION
- FAMILY LAW
- CORPORATION / COMMERCIAL TRANSACTIONS
- FRANCHISE CLOSING

Avni Shah
B.A., JD
Barrister & Solicitor

ashah@sslawyers.ca
Tel : 416-818-4000
Fax : 416-740-4002

1780 ALBION ROAD, UNIT # 8, TORONTO ONTARIO M9V 1C1



કેનેડામાં મંકીપોકસના ૬૮૧ કેસની પૃષ્ઠી, તંત્ર હરકતમાં

વાયરસને પ્રસરતો અટકાવવા આવશ્યક તમામ પગલા લેવાશે : દર્દીઓ સાથે સીધો સંપર્ક નહીં સાધવા આમજનતાને અપીલ

ટોરોન્ટો

કેનેડાએ મંકીપોકસના ૬૮૧ કેસની પૃષ્ઠી કર્યા બાદ વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશન (ડબલ્યુએચઓ)એ શનિવારે વૈશ્વિક આરોગ્ય કટોકટી જાહેર કરી હતી. કેનેડાના જાહેર આરોગ્ય વિભાગના નિવેદન મુજબ કેસોની સંખ્યામાં વધારો થવાની શક્યતાઓ છે. આરોગ્ય વિભાગે આંતરરાષ્ટ્રીય, પ્રાંતિય અને વિભાગીય આરોગ્ય સંસ્થાઓ સાથે મળીને આ વૈશ્વિક સ્થિતિનું આકલન કરી મંકીપોકસના વાયરસને કેનેડામાં વધુ પ્રસરતા અટકાવવો પડશે, એમ પણ જણાવવામાં આવ્યું હતું.



વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, કેનેડા હુ અને તેના આંતરરાષ્ટ્રીય ભાગીદારો સાથે સતત સંપર્કમાં રહીને મંકીપોકસના પ્રસારને અટકાવવા પ્રયાસ કરશે. આ મહિનાની શરૂઆતથી

સેક્સ માણતી વખતે તકેદારી રાખવા આરોગ્ય વિભાગ દ્વારા ખાસ તાકીદ

આરોગ્ય વિભાગના સુશ્રોએ જણાવ્યું હતું કે, તેમણે કેનેડીયનોને સુરક્ષિત સેક્સ માણવા અને તે સમયે પુરતી તકેદારી રાખવાની સલાહ પણ આપી હતી. વાયરસના પ્રસારનો અભ્યાસ ચાલી રહ્યો છે. તેમણે કહ્યું કે કેટલાક સેક્સ પાર્ટનરોમાં રોગના લક્ષણો ન હોય તો પણ ચેપ લાગવાનો ખતરો રહે છે.

નહીં આવવાની સુચના પણ લોકોને આપી હતી. આરોગ્ય વિભાગે લોકોને સ્વચ્છતા જાળવવા અને ઈન્ફેક્શનથી બચવા પણ જણાવ્યું હતું. ૨૧મી જુલાઈએ સરકારે જાહેરાત કરી હતી કે, વાયરસના પ્રભાવિત વિસ્તારોમાં કામ કરી રહેલી સામાજિક સંસ્થાઓને આર્થિક સહાય કરાશે. મંકી પોકસનો ફેલાવો વધતા જ કેનેડા સરકારે તમામ પ્રાંતોને મંકીપોકસના પ્રસારને અટકાવવા શ્રેષ્ઠ કામગીરી કરવા તૈયાર રહેવા તાકીદ કરી છે. આરોગ્ય વિભાગે રોગ વિશેની તાજ જાણકારી લોકોને નિયમિત રીતે આપવાની ખાતરી આપી છે.

મોજ, મસ્તી અને ગીત સંગીતના સથવારે હોલ્ટન સિનિયર્સ ગ્રુપની પીકનીક યોજાઈ

સભ્યોએ બટરફ્લાય કન્ઝર્વેટરીઝ અને ગાર્ડન ઓએસિસ મુલાકાત લીધી, રમતો બાદ અંતાક્ષરી રમાઈ



ઓન્ટેરિયો

ગત રવિવાર તારીખ 24 જુલાઈ 2022ના રોજ વેલેન્ડ કેનાલ અને નાયગ્રા ફોલ્સ, ઓન્ટેરિયો ખાતે હોલ્ટન સિનિયર્સ ગ્રુપની પીકનીક યોજાઈ હતી. વેલેન્ડ કેનાલ, દક્ષિણ ઓન્ટેરિયો, કેનેડામાં આવેલો જળમાર્ગ, દક્ષિણમાં લેક એરી અને ઉત્તરમાં ઓન્ટેરિયો તળાવ વચ્ચે મોટા જહાજો માટે નેવિગેશન પૂરું પાડે છે. સવારે નવ વાગ્યે સભ્યો પીકનીકમાં જોડાયા અને સૌને ચા-કોફી ફ્રાફડા ગાઠીયા અને કોબી, ગાજર અને મરચાનો સંભારા પીરસાયો. સભ્યો “ફલાવર કલોક” નાઈગરા ફોલ્સ પહોંચ્યા બાદ ઉત્તર અમેરિકામાં સૌથી મોટા કાય-બંધ બટરફ્લાય કન્ઝર્વેટરીઝની અને ગાર્ડન ઓએસિસ મુલાકાત લીધી. આ સ્થળ નાયગ્રા પાર્કના બોટનિકલ ગાર્ડન, ફૂલો, લીલીછમ વનસ્પતિથી છવાયેલું વિશાળ પાર્ક, સહેલાણીઓથી ઉભરાતું હતું. તેમાં નાયગ્રા

પાર્ક બટરફ્લાય કન્ઝર્વેટરી ખાતે 2,000થી વધુ વાઈબ્રન્ટલી રંગીન પતંગિયાઓ ટપકતા ધોધથી સુશોભિત વિન્ડિંગ પાથ પર મુક્તપણે લહેરાતા હતા. પતંગિયાતો દરેકના હાથ, માથા, કપડાં પર બેસી જતા હતા.

તે પછી “વર્લ્ડપૂલ એરો કાર”ની મુલાકાત કરી, જ્યાં બપોરનું જમવામાં ગરમ ગરમ પુરણપોળી પુરી, શ્રીખંડ, ખમણ ઢોકળા, મસાલા ભીંડીનું શાક, વટાણા બટેટાનું શાક, કઢી અને પુલાવ પીરસવામાં આવ્યા હતા. એકાદશીનો દિવસ હોવાથી ઉપવાસી મેમ્બરસ માટે શ્રીખંડ અને સાબુદાણાની ખીચડી પીરસવામાં આવી હતી. જે પછી પાર્કમાં લીબુ, અને ચમચાની રમતમાં સૌએ હોંશે હોંશે ભાગ લીધો. ડોક્ટર શેલેશભાઈ પારેખનો તે દિવસે જ “હૉનો જન્મ દિવસ” હતો. એટલે “હેપ્પી બર્થ ડે”નાં ગીતથી બધાએ તેમને વધાવી લીધા. જે બાદ મસ્તી આંનદની રમજટ “અંતાક્ષરી” રમવામાં આવી હતી.

હોસ્પિટલના લાભાર્થે સપ્ટેમ્બરમાં યોજાશે વોલ્કેથોન

મિસિસાગા

ત્રિલિયમ હેલ્થ પાર્ટનરની ત્રણ હોસ્પિટલ કેરિટ વેલી, મીસિસોગા હોસ્પિટલ અને કવિનસ હેલ્થ સેન્ટર માટે ફંડ એકત્ર કરવા 11 સપ્ટેમ્બરના રોજ મીસિસોગા પાર્ક વેલી, એરીયા B ખાતે ગુજરાતી સિનિયર્સ સમાજ ઓફ મિસિસોગા દ્વારા વોલ્કેથોનનું આયોજન કરવામાં આવ્યું છે.

વોલ્કેથોનનો કાર્યક્રમ 11 સપ્ટેમ્બરે સવારે 8:30 વાગે શરુ થશે. સૌપ્રથમ નાસ્તો વહેંચાયા

બાદ 9:30 કલાકે Walkathonનો આરંભ થશે. આ દિવસે તમારા નામનું રજીસ્ટ્રેશન થશે તથા Donations પણ લેવામાં આવશે. ઓછામાં ઓછું \$ ૫૦ સ્વીકારવામાં આવશે

આ માટે ફંડ રેસિંગ કમિટીના કનુભાઈ પટેલ, કલાબેન પટેલ (647 402 6150), દિલીપભાઈ પટેલ (647 990 3178)નો સંપર્ક કરી શકાશે. કાર્યક્રમ માટે સોશિયલ મીડિયાની કામગીરી ધ્રુવભાઈ શાહ (Guelph 519 760 3938) સંભાળી રહ્યા છે.

મિસિસાગામાં ટ્રેનની ટક્કરથી બાળકનું મોત

મિસિસાગા

ઓન્ટેરિયોનાં મિસિસાગામાં મંગળવારે સાંજે GO ટ્રેનની અડકેટે ચાર વર્ષનાં બાળકનું મૃત્યુ થયું હતું. મિસિસાગા ફાયર વિભાગે ટ્રિવટમાં પુષ્ટિ કરી છે કે ડુંદાસ સ્ટ્રીટ અને કાવથ્રા રોડ વિસ્તારમાં એક બાળક GO ટ્રેનની અડકેટે આવી ગયું હતું. સાંજે લગભગ 7.40 વાગ્યે ફોન આવ્યો હતો. ફાયર સર્વિસે કહ્યું કે, પેરામેડિક્સ અને પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.

એક સાક્ષીએ મીડિયા સમક્ષ કહ્યું કે તે અને કેટલાક મિત્રો નજીકમાં ઉભા હતા ત્યારે તેઓએ

જોરથી ટ્રેનના હોર્નનો અવાજ સાંભળ્યો હતો. અમે ટ્રેનનું હોર્ન મોટેથી સાંભળ્યું, એટલે અમે એકબીજા તરફ જોયું અને અમને લાગ્યું કે કંઈક થયું છે અને પછી થોડી મિનિટો પછી અમે આ દુર્ઘટના વિશે સાંભળ્યું. પછી અમને સમજાયું કે ટ્રેને એક નાના બાળકને ટક્કર મારી હતી. આ વિસ્તારના લોકોએ જણાવ્યું કે તેઓ કેટલાક સમયથી ટ્રેનના પાટા પાસે કોઈ ફાટક ન હોવાથી ચિંતિત હતા. એક તબક્કે ફાટક બનાવવા માટે અરજી કરવાનું વિચાર્યું હતું. કારણ કે તેણે ત્યાર સુધીમાં ઘણા રાહદારીઓને ટ્રેકની નજીક જોખમી રીતે આવતાં-જતાં જોયાં છે.

THINKING OF BUYING, SELLING OR INVESTING?

આપના વિશ્વાસુ અને ભરોસાપાત્ર

અમારી રીયલ એસ્ટેટ અને ઇન્વેસ્ટમેન્ટ્સની મફત સલાહ નો લાભ ઉઠાવવા માટે આજે જ સંપર્ક કરો.
મોર્ટગેજ જોઇએ છે? અમે મદદ કરી શકીએ છીએ!

CALL 416 893 4585 TODAY!!!

SUBHRO CHAKRABORTY
SALES REPRESENTATIVE

SUDHIR PARMAR
SALES REPRESENTATIVE

Call us **TODAY** for all of your Real Estate needs and get honest, reliable and professional Service you can count on.

- ✓ Residential
- ✓ New Construction
- ✓ Investment
- ✓ Commercial

MOHAMMAD ABOWATH
SALES REPRESENTATIVE

MAAZ ABOWATH
BROKER - TEAM LEADER

IBRAHIM ABOWATH
SALES REPRESENTATIVE

416 893 4585

ABOWATH

REAL ESTATE GROUP

VALUING RELATIONSHIPS OVER TRANSACTIONS EVERY SINGLE TIME!

ABOWATH.COM

RE/MAX
CROSSROADS REALTY INC.
#SellWithABOWATH
Your Local REALTOR



તંત્રી સ્થાનેથી

બરવાળા લઘુકાંડ : પાપી રાજનેતા તેમજ પોલીસ તંત્ર જ જવાબદાર

મહાત્મા ગાંધીની જન્મભૂમિ ગુજરાતમાં વર્ષોથી દારુ બંધીને નામે ચાલતા નાટકમાં ચાર દિવસ પહેલાં વધુ એક કુરુણાતિકા સર્જાઈ. રાજ્યના બોટાદ જિલ્લાના બરવાળા પાસે



તંત્રી - પ્રકાશક સ્વદેશ

સર્જાયેલા લઘુકાંડમાં કુલ 42 લોકોના મોત થયા અને હજી 60 લોકો હજી જુદી જુદી હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે. જેમની હાલત બહુ ખરાબ નથી એવા કેટલાક દર્દીઓને સ્થાનિક કક્ષાએ બોટાદ ખાતે દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે જેમની હાલત ગંભીર હતી એવા લોકોને ભાવનગરની સર ટી હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ દારુડિયાઓમાંથી 12 લોકોની હાલત એકદમ ગંભીર થઈ જતાં તેમને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લવાયા છે.

આ પ્રકરણમાં પ્રથમિક તપાસમાં દારુડિયાઓએ સીધું જ મિથાઈલ આલ્કોહોલ નામનું ઝેરી કેમિકલ પીધું હોવાનું બહાર આવ્યું છે. આ સંજોગોમાં મૃત્યુઆંક હજી વધે એવી પૂરી શક્યતા છે. જેમણે પણ દારુ પીધો એ બધાંએ કાયદાનો ભંગ કર્યો છે. આ સાથે જ આ લઘુકાંડે ગુજરાતની દારુબંધીની પોલ ફરી ખોલી નાંખી છે. ગુજરાતમાં કહેવા ખાતર દારુબંધી છે પણ વાસ્તવિકરિતે દારુબંધી નથી તેનો આ વધુ એક પુરાવો છે. આ પુરાવા રોજરોજ મળે છે અને સાબિત થાય છે કે, દારુબંધીનો અમલ માત્ર કાગળ પર જ થાય છે. રાજ્યમાં સરકાર કોંગ્રેસની હોય કે ભાજપની હોય, વર્ષોથી દારુબંધીને નામે માત્ર નાટકો જ થયા છે. કમનસીબી એ છે કે, આ વખતે તેમાં ત્રીસ-ચાલીસ લોકોએ પોતાના જીવ ખોયા છે. હવે ગુજરાતની ભાજપ સરકાર પોતાની નિષ્ફળતા ઢાંકવા ધમપછાડા કરી રહી છે. જો કે, આ વાત ઘોડા છૂટી ગયા પછી તબેલાંને તાળાં મારવા જેવી છે. લઘુકાંડથી સરકારની શાખ દાવ પર લાગતી અને આખા દેશમાં બદનામી થતાં હવે દોષનો ટોપલો બીજા પર ઢોળવાના પ્રયાસો શરૂ થયા છે. સૌથી પહેલાં તો એવું જાહેર કરી દેવાયું છે કે, આ લોકોના મોત દારુ પીવાથી નહીં પણ કેમિકલ પીવાથી થયા છે. આ ઉપરાંત બોટાદના ડીવાયએસપીના વડપણ હેઠળ એક સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી) બનાવી દેવાઈ. આ એસઆઈટી લઘુકાંડની તપાસ કરીને સરકારને રિપોર્ટ સોંપશે. એસઆઈટીની સાથે સાથે સ્ટેટ મોનિટરિંગ સેલ અને અમદાવાદ કાર્મ બ્રાંચને પણ લઘુકાંડની તપાસ કરવાનો આદેશ અપાયો છે. લઘુકાંડમાં મોતનો બિનસત્તાવાર આંકડો 75થી વધુ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે હવે આ મામલે ગૃહ વિભાગ એક્શનમાં આવ્યું છે. ગૃહ વિભાગે SP કક્ષાના 2 અધિકારીઓની બદલી કરી છે તથા PSI સહિત 5 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. લઘુકાંડના પગલે સફાળી જાગેલી ભૂપેન્દ્ર પટેલની સરકારે આખા રાજ્યમાં દેશી દારુના અડાઓ ઉપર દરોડા પાડવા માટે પણ ફરમાન કરી દીધું છે. તેના પગલે પોલીસે દારુની ભઠ્ઠીઓ પર તૂટી પડવાનું નાટક શરૂ કર્યું છે.

સરકાર કોઈપણ ભોગે એ સાબિત કરવા

મથી રહી છે કે, ગુજરાતમાં લઘુકાંડ નથી સર્જાયો પણ કેમિકલ કાંડ સર્જાયો છે. કેટલીક ન્યુઝ ચેનલો અને મીડિયા પણ આમાં સરકારને સહયોગ આપી રહી છે. ટૂંકમાં આ બધાં નાટકો હમાખોર રાજકારણીઓ અને પોલીસનાં પાપ ઢાંકવા માટે કરાઈ રહ્યાં છે.

પોલીસનો દાવો છે કે, દારુ બનાવનારને કેમિકલ આપનાર મુખ્ય આરોપીને અમદાવાદ કાર્મ બ્રાંચે ઝડપી પાડ્યો છે. તેની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, પીપલજ પાસેથી ફેક્ટરીમાંથી મિથેનોલ સપ્લાય કરવામાં આવતું હતું. દારુ બનાવનાર આરોપીનો સ્વજન જ કેમિકલ સપ્લાય કરતો હતો. દેશી દારુમાં મિથેનોલ ભેળવાયો તેના કારણે દારુ વધારે પડતો ઝેરી થઈ ગયો અને ત્રીસેક લોકોએ જીવ ગુમાવ્યા.

હકીકતમાં આ વાત મૂર્ખામી જેવી છે. દેશી દારુ બનાવવાય તેમાં જાત જાતની વસ્તુઓ નંખાય છે. દારુ પીનારાંને કીક આવે એ માટે દારુ બનાવનારા એવી એવી વસ્તુઓ નાંખતા હોય છે કે જેની વાતો સાંભળીને ઉબકા આવી જાય. મિથેનોલ એચલે કે મિથાઈલ આલ્કોહોલ તેમાંથી જ એક છે. બીજું એ કે, દેશી દારુ બનાવવાય ત્યારે જે રસાયણિક પ્રક્રિયા થાય છે તેમાં પણ મિથેનોલ તો પેદા થાય જ છે. તેથી દેશી દારુમાં મિથેનોલ તો હોય જ છે.

આખા વિવાદમાં સવાલ એ જ છે કે, ગુજરાતમાં દારુબંધી હોવા છતાં દારુની ભઠ્ઠીઓ કેમ ધમધમે છે? આ સવાલનો જવાબ પોલીસ કે સરકાર આપી રહી નથી. વળી લઘુકાંડ થયો પછી દારુની ભઠ્ઠીઓ પર તૂટી પડવા પોલીસને ફરમાન કરાયું છે. તો અત્યાર સુધી સરકારને આ અડાઓ કે ભઠ્ઠીઓ અંગે ખબર જ ન હતી? એક શાસક તરીકે ભાજપે પોતાને આ સવાલ પુછવો જોઈએ કે, અમને કાંઈ ખબર ન હતું તો પછી રાજ કરવાનો અધિકાર છે ખરો,

ખેર વાત ભલે ગમે તે હોય પરંતુ હકીકત તો એ છે કે, ગુજરાતમાં રાજકારણીઓ અને પોલીસની રહેમ નજર હેઠળ જ ગેરકાયદેસર રીતે દારુનો ધંધો ધમધમે છે. ગુજરાતમાં દારુનો ધંધો કરનારા બુટલેગરો પોલીસ અને રાજકારણીઓને તગડા હાથે આપે છે. મતલબ કે, જે રકમ કરવેરા પેટે સરકારી તિજોરીમાં જવી જોઈએ એ હાથ પેટે કરોડો અને અબજો રૂપિયા રાજકારણીઓ અને પોલીસોનાં ઘરોમાં જાય છે. આ હાથના બદલામાં પોલીસ-રાજકારણીઓ બુટલેગરોને છાવરે છે, તેમને રક્ષણ આપે છે. બરવાળા જેવો લઘુકાંડ સર્જાય ત્યારે લોકોના ધ્યાન પર આ વાત આવે છે, બાકી તો બેરોકટોક આ વેપલો ચાલ્યા કરે છે. રાજકારણીઓ-પોલીસના પાપે ગુજરાતમાં દારુનું એક સમાંતર અર્થતંત્ર ઊભું થયું છે. આ અર્થતંત્રના કારણે ગુનાખોરીનું બહુ મોટું સામ્રાજ્ય ઊભું થયું છે. જેને દારુબંધી હટાવીને તોડી શકાય પણ રાજકારણીઓ પોતાની દુકાન ચાલે એટલા માટે ગાંધીજીના નામે દારુબંધીનું તૂટ ચલાવ્યા કરે છે. ખુદ મોદીએ પણ ગુજરાતમાં 2002થી 2014 સુધી સરકાર ચલાવી ત્યારે પણ આ વેપલો યથાવત રહ્યો હતો. એટલે ભાજપ કે કોંગ્રેસ આ બાબતે કોઈને દોષ દઈ શકે તેમ નથી.

મનોજ ગાંધી

manoj1968@yahoo.ca

ARISTO PEST CONTROL

Set your mind at rest, we will get rid of the pest

647-339-3926 | aristopest@gmail.com | www.aristopestcontrol.com

✓ Mice

✓ Rat

SAME DAY SERVICE - RESIDENTIAL, COMMERCIAL, INDUSTRIAL

✓ Cockroach

✓ Bedbug

WE SPEAK ENGLISH, GUJARATI & HINDI

✓ Animal Control

✓ Bird Control

✓ WASPS and

✓ Hive Removal

24 HRS / 7 DAYS EMERGENCY SERVICES AND ANIMAL REMOVAL

We also provide No Obligation Inspection for Commercial and Residential Clients.

Written Guarantee And Discounted Rates

CALL SANKET TRIVEDI - 647.339.3926

Government Licensed Structural Exterminator

DIVINE YOGA

By Geeta

Children Yoga Class

Every Tuesday 5-6 PM

Adult Yoga Class

Every Saturday 9-10 AM

Join-today-on-ZOOM!

: Classes Available :

One to One Individual and Therapeutic

Geeta Tailor

416-456-2261

Contact Geeta at divineyogabygeeta@gmail.com

IG & FB: @divineyogabygeeta

સુરતમાં ભાજપના બટલેગર સાથે સંકલન મુદ્દે 'આપ'ના કોર્પોરેટરો સાથે ઝપાઝપી

પોલીસનો ડબ્બો લાવીને આપના કોર્પોરેટને લાલગેટ પોલીસ મથકે લઈ જવાયા

સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા પુર્ણ થવાના આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો લઠાકાંડ મુદ્દે ભાજપ નેતાઓ બુટલેગર સાથે સંકલન કરે છે તેવા પેકેજેટ લઈને બેન્ય પર ઉભા થઈ જતા ધમાસણ મચ્યું હતું. સભા તુરંત બરખાસ્ત દેવાઈ હતી પણ ત્યારબાદ આપ અને ભાજપના કોર્પોરેટરો વચ્ચે ઝપાઝપી અને મારામારી થઈ ગઈ હતી.

પોલીસ બોલાવાઈ હતી અને તે આપના કોર્પોરેટરોને વાનમાં લાલગેટ પોલીસ મથકે લઈ ગઈ હતી. સભામાં ભાજપ નેતાઓનું બુટલેગર સાથે સંકલન બેનરો પ્રદર્શીત કરતા સભા બરખાસ્ત કરાઈ હતી. ત્યારબાદ કોર્પોરેટરો બહાર નીકળી રહ્યા હતા ત્યારે આપના કોર્પોરેટર મહેશ અણઘણે ફરી ભાજપ નેતાઓના સંદર્ભમાં બુટલેગર શબ્દપ્રયોગ કરતા ભાજપના

કોર્પોરેટર દિનેશ રાજપુરોહીતે તે અંગે વિરોધ નોંધાવ્યો હતો. બંને વચ્ચે વાત વણસે તે પહેલા સિક્યુરીટી ગાર્ડસ બંને વચ્ચે ઉભા રહી ગયા હતા. દરમિયાન આ વાતની જાણ થતા અન્ય કોર્પોરેટરો ધસી આવ્યા હતા અને મહેશ અણઘણને ઘેરી લઈ ટપલીદાવ કરતા ઝપાઝપી અને મારામારીની દ્રશ્યો સર્જાયા હતા. જેમાં ભાજપના એક કોર્પોરેટરનો શર્ટ પણ ફાટી ગયો હતો.

સુરત પાલિકાના સીટી લાઈટ સાયન્સ સેન્ટર ખાતે ખોજ મ્યુઝિયમ બનાવાશે

સુરત સુરતના સરદાર પટેલ મ્યુઝિયમને નવો જ લુક આપવામાં આવી રહ્યો છે. આ મ્યુઝિયમ વધુ લોકપ્રિય બને તે માટે આગામી દિવસોમાં આ મ્યુઝિયમમાં ખોજ મ્યુઝિયમ બનાવવા માટે કવાયત થઈ રહી છે. આપન ઈનોવેટીવના આધારે સાયન્સ મ્યુઝિયમ માટે આયોજન થઈ રહ્યું છે. સુરત પાલિકાના સાયન્સ સેન્ટર ખાતે આવેલા મ્યુઝિયમમાં બે થીમ બેઈઝ ગેલેરી તથા એક્ટીવીટી એરિયા-ઈનોવેશન સેન્ટર ડેવલપ કરવામાં આવશે. સુરત સાયન્સ સેન્ટર ખાતે

આવેલા મ્યુઝિયમ ગ્રાઉન્ડ સહિત પહેલો માળ મળીને 1200 ચોરસ મીટર જગ્યામાં વિજ્ઞાન વિષયને આધારીત ખોજ મ્યુઝિયમ સ્થાપવા અંગે ગુજરાત સીએસઆર ઓથોરિટી દ્વારા પત્ર લખીને રજૂઆત કરવામાં આવેલ હતી. જે સંદર્ભે વહીવટી તંત્ર દ્વારા આગામી પાંચ વર્ષ સુધી મ્યુઝિયમની ખાલી પડેલી જગ્યામાં ખોજ મ્યુઝિયમ બનાવવા રજૂઆત કરવામાં આવી છે. પાલિકાના મ્યુઝિયમમાં બે અલગ-અલગ થીમ બેઈઝ ગેલેરી અને એક્ટીવીટી એરિયા સહિત ઈનોવેશન સેન્ટર ડેવલપ કરવામાં આવશે.

Imperial PEST CONTROL

Residential • Commercial • Industrial

24 Hour Service • 7 Days a Week



Preventing the Spread of COVID-19 :
Our disinfectant services that we offer are:

- 1 Spray Services
- 2 Fogging Services
- 3 Sanitation Services

All Pest Control:
Mouse & Rats, Cockroaches, Bedbugs, Silver Fish, Spiders & Fleas, Carpenter Ants. Total Interior & Exterior Pest Control

Removal:
Bees & Wasps, Pigeon, Squirrels, Raccoon, Skunk, Nest & Hive, Hornets, Yellow Jackets

First Time Customer gets **10% Off** on your first home service
*Mention this offer while booking

Free Estimates & Written Guarantee

Special Service For Bedbug Control

www.imperialpestcontrol.ca
info@imperialpestcontrol.ca
(We speak English, हिन्दी, ગુજરાતી)

Call: Ramesh Kanani 416-837-1820

ગોવર્ધનથાળ

સ્વાદિષ્ટ શુદ્ધ શાકાહારી ગુજરાતી ભોજન

Weekend Special

રગડા પેટિસ, પાંઉભાજી, છોલેપુરી, ફટલેસ, ખાસ્તા કચોરી, સેવ ઉસળ, સમોસા ચાટ

Takeout & Catering

Limited થાળી
(with sweet & Farsan)
\$9.00 +Tax

Limited થાળી
(without sweet & Farsan)
\$7.50 +Tax



CATERING SPECIAL

\$ 14.99 10 items
+Tax
Sweet, Farsan, Subji, Kathor, Puri, Dal, Rice Papad, Pickle, Kachumber

Franchise Opportunity in GTA

Call us for details

રસોઈકામ કરી શકે તેવા બહેનોની જરૂર છે.

ફોન નં: ૪૧૬-૪૩૮-૦૫૪૪

૪૧૬-૫૨૦-૨૯૨૨, ૪૧૬-૪૩૪-૮૧૨૧

૯૪૦, મારખમ રોડ, સ્કારબોરો, ઓન્ટેરીયો, કેનેડા, M1H2Y2



મહેસાણા ડિસ્ટ્રીક્ટ બેંકના વાર્ષિક ચેરમેનની ચૂંટણીનું કોકડું અનેક દિવસો બાદ ઉકેલાયું

કેશુ પટેલનો મેન્ડેટ આવતા દશરથ પટેલ જૂથ નારાજ થયું પણ છેવટે સમજાવી લેવાયું

મહેસાણા

મહેસાણા ડિસ્ટ્રીક્ટ બેંકમાં આગામી અઢી વર્ષની ટર્મ માટે ચેરમેનપદ અને વાર્ષિક ચેરમેનપદ માટે યોજાયેલી ચૂંટણીમાં ભાજપના બે જૂથ વચ્ચે હુંસાતૂંસી થતા રહી ગઈ હતી. ચેરમેનપદે વિનોદ પટેલને રીપીટ કર્યા બાદ વાર્ષિક ચેરમેનપદ માટે પ્રદેશ ભાજપે કેશુ પટેલના નામનો મેન્ડેટ આપતાં બેંકના બોર્ડ રૂમમાં અઢી કલાક સુધી કોકડું ગૂંચવાયું હતું. નારાજ થયેલા દશરથ પટેલ જૂથને સમજાવીને ઉમેદવારી

પરત ખેંચાવી લેતાં વાર્ષિક ચેરમેનપદની ચૂંટણીનું કોકડું અઢી કલાકે ઉકેલાતાં વાર્ષિક ચેરમેનપદે કેશુ પટેલ બિનહરીફ ચૂંટાઈ આવતા મામલો થાળે પડ્યો હતો. મહેસાણા ડિસ્ટ્રીક્ટ બેંકના ચેરમેન અને વાર્ષિક ચેરમેનની પ્રથમ અઢી વર્ષની મુદત પૂર્ણ થતાં બીજી અઢી વર્ષની મુદત માટે સોમવારે બેંકના બોર્ડ રૂમમાં ચૂંટણી યોજાઈ હતી. પ્રાંત અધિકારી એમ.બી. પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલી ચૂંટણી દરમિયાન પ્રદેશ ભાજપ દ્વારા ચેરમેન તરીકે વિનોદ પટેલનો મેન્ડેટ આવ્યો

હતો. જ્યારે વાર્ષિક ચેરમેન તરીકે પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ કેશુ પટેલનો મેન્ડેટ આવ્યો હતો. ચેરમેનપદની ચૂંટણીમાં કોઈ હરીફ ઉમેદવાર નહીં હોવાથી બે મિનિટમાં શાંતિપૂર્ણ રીતે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. જે બાદ ભાજપના મેન્ડેટના આધારે કેશુ પટેલને વાર્ષિક ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટીને ધીના ઠામમાં ઘી પાડવામાં આવ્યું હતું. ચેરમેન તરીકે વિનોદ પટેલ અને વાર્ષિક ચેરમેન તરીકે કેશુ પટેલ બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા.

ડ્રગ્સનું સપ્લાય કરનાર મુંબઈની રૂબી, અબ્દુલ્લા, વસીમ, ભૂગર્ભમાં ઉતરી ગયા

વડોદરા

વડોદરામાં ડ્રગ્સ પહોંચાડતી વર્ષાને ડ્રગ્સ પુરું પાડનાર અબ્દુલ્લા તેમજ રૂબીને શોધવા ગયેલી પોલીસને બંનેનો કોઈ પત્તો મળ્યો નથી. જેથી એસઓજીની ટીમ મુંબઈ પોલીસની સાથે સંપર્કમાં રહી તપાસ ચાલુ રાખશે. હરણીરોડની શાંતિકુંજ સોસાયટીમાં રહેતા ગૌરાંગ શાહ પાસે રૂ.૧૫ લાખનું પાર્ટી ડ્રગ્સ મળી આવતાં એસઓજીના પીઆઈ સી બી ટંડેલ અને આર એ પટેલે ગૌરાંગને ડ્રગ્સ સપ્લાય કરતી નવી મુંબઈની વર્ષા રાઠોડને ઝડપી પાડી હતી. વર્ષાને પાંચ દિવસના રિમાન્ડ પર લઈ પૂછપરછ કરવામાં આવી હતી. જે

દરમિયાન વર્ષાએ મુંબઈના અબ્દુલ્લા પાસે ડ્રગ્સ મેળવતી હોવાની કબૂલાત કરતાં અબ્દુલ્લાની વિગતો મેળવી એસઓજીની ટીમ મુંબઈ પહોંચી હતી. પરંતુ અબ્દુલ્લા ભૂગર્ભમાં ઉતરી ગયો હોવાનું જણાઈ આવ્યું છે. પોલીસને મળેલા અબ્દુલ્લાના મોબાઈલ નંબરો પણ બંધ હોવાથી પોલીસ તેની તપાસ માટે ફરીથી મુંબઈ જશે. આ ઉપરાંત વડોદરા એસઓજી અબ્દુલ્લાની સાથે સાથે વડોદરામાં ડ્રગ્સ સપ્લાય કરતી મુંબઈની રૂબીની પણ તપાસ કરી રહી છે. જે માટે મુંબઈ પોલીસની પણ મદદ લેવામાં આવી રહી છે.

પાટણમાં વિદ્યાર્થીની પાસે અઘટિત માંગણી કરનારને ઝાડ સાથે ઊંધો લટકાવી ફટકાર્યો

પાટણ

પાટણના સરસ્વતી તાલુકાની વિદ્યાર્થીની કોઈટામાં શાળાએ જતી હતી ત્યારે ગામના જ શખસે અઘટિત માંગણીનો પ્રયાસ કર્યો હતો. પરંતુ જ્યારે વિદ્યાર્થીની તાંબે ના થઈ ત્યારે આરોપીએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી દીધો હતો. ત્યારબાદ વિદ્યાર્થીનીને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. ત્યારે હાલ એક વીડિયો વાયરલ થયો છે, જેમાં આરોપીને ગામલોકોએ ઝાડ સાથે ઊંધો લટકાવી ઢોર માર માર્યો હતો. વિદ્યાર્થીની પર હુમલો કરનારને લોકોએ બાંધીને ઝાડ પર લટકાવી માર્યાનો વિડીયોથી ખળભળાટ મચી જવા પામ્યો છે.

નવવધુ સાસરે પહોંચી ત્યાં જ પતિની પ્રેમિકાએ સ્યુસાઈડની ધમકી આપી

વડોદરા

વડોદરાની એક પરિણીતાને લગ્નના એક જ મહિનામાં પતિનો વરવો અનુભવ થયો હતો. પતિની પ્રેમિકા તરીકે એક યુવતીએ વાત કરતાં પત્ની ચોંકી ઉઠી હતી. આખરે પતિ અને સાસરીયાના ત્રાસથી કંટાળીને તેણે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પરિણીતાએ પોલીસને કહ્યું છે કે, મારા લગ્ન માર્ચ-૨૦૧૯માં સમતા પોલીસ ચોકી પાછળ રહેતા યુવક સાથે થયા હતા. લગ્ન પહેલાં એક બીજાને પસંદ કરવા

માટે મીટિંગ રાખી ત્યારે યુવકે કોઈ વ્યસન કે કોઈ છોકરી સાથે સબંધ નહિં હોવાનું કહ્યું હતું. પરંતુ લગ્નના એક જ મહિનામાં એક યુવતી ઘેર આવી હતી અને તેણે હું સ્યુસાઈડ કરી લઈશ.. તારું નામ લખી દઈશ.. તેમ કહેતાં મને આઘાત લાગ્યો હતો.

આ અંગે મેં મારા પતિને પૂછતાં તેણે કહ્યું હતું કે, મારા જીવનમાં તારું જ અસ્તિત્વ છે. યુવતી મારી પાછળ પ્રેમમાં પાગલ છે. ત્યારબાદ મારો પતિ દારૂ પણ પીતો હોવાનું જણાઈ આવતાં સાસુને કહ્યું તો તેણે પણ ઉડાઉ જવાબ આપ્યો હતો.

ગુજરાતમાં નવતર પ્રયોગ, મચ્છરોનો ઉપદ્રવ ડામવા હવે ડ્રોનનો ઉપયોગ કરાશે

મહેસાણા

જિલ્લામાં ચોમાસા દરમિયાન હવે મચ્છરોનો ઉપદ્રવ વધવા લાગ્યો છે અને તેના કારણે મચ્છરજન્ય રોગ ફેલાય એવી દહેશત જોવા મળી રહી છે. આથી મચ્છરના ઉપદ્રવને ડામવા આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના હસ્તે મચ્છરના લાર્વાની નાબુદી માટે ડ્રોનની મદદથી ઓર્ગેનિક લાર્વિસાઈડ છંટકાવના પાયલોટ પ્રોજેક્ટનો મહેસાણા જિલ્લાના વિસનગરથી પ્રારંભ કરાવ્યો છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ સેન્સર આધારિત ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરી મચ્છરના ઉપદ્રવને ડામવા મહેસાણા જિલ્લાથી ઝુંબેશનો પ્રારંભ કરાવ્યો છે.



UNLOCK HIDDEN GEMS IN REAL ESTATE

CALL US TO FIND PROPERTY WITH POSITIVE CASH FLOW

ZIVASA
Realty Inc., Brokerage

647.972.1000

www.zivasa.com



Bhagat Dhull



Bharat Batra



Harit Gaba



Himanshu & Anshu Batta



Rajiv Arora



Rajesh Khurana
Broker

આણંદ પાલિકાની સામાન્ય સભા તોફાની બની : વિપક્ષે ચીફ ઓફિસરને ધક્કે ચઢાવ્યા

વિપક્ષ દ્વારા જૂના રેકર્ડના ભરાવાના નાશ અંગેના કામ નં. 8 નો વિરોધ કરાયો

આણંદ
વિપક્ષના હોબાળા વચ્ચે આજે યોજાયેલ આણંદ નગરપાલિકાની સામાન્ય સભા તોફાની બની હતી. વિરોધ પક્ષ દ્વારા પોતાની રજૂઆતો સાંભળ્યા વિના સભા આટોપી લેવા મુદ્દે હોબાળો મચાવી નગરપાલિકાના ચીફ ઓફિસરને ધક્કે ચઢાવતા ભારે હોબાળો મચ્યો હતો. દરમ્યાન નગરપાલિકાના ચીફ ઓફિસરે સભાખંડની બહાર જવા માટે વૈકલ્પિક માર્ગે પોતાની ઓફિસમાં જવાની ફરજ પડી હતી.

આણંદ નગરપાલિકાના પ્રમુખ રૂપલબેન પટેલની અધ્યક્ષતામાં સામાન્ય સભા યોજાઈ હતી. વંદે માતરમના ગાન સાથે સભાની શરૂઆત થયા બાદ તુરત જ વિપક્ષી કાઉન્સીલરોએ કેટલાક કામોને લઈ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. જેને લઈ સભાખંડમાં ભારે અફરાતફરી મચી હતી. દરમ્યાન શાસક પક્ષ દ્વારા એજન્ડાના કુલ-૮૯ કામોને બહુમતીથી મંજૂરીની મહોર મારી ગણતરીની મિનિટોમાં સભા આટોપી લેવામાં આવી હતી અને પાલિકા પ્રમુખ

સહિત ચીફ ઓફિસર સભાખંડ ખાતેથી પોતાની ચેમ્બર તરફ જવા રવાના થયા હતા. મહિલા પ્રમુખ સભાખંડમાંથી નીકળી ગયા હતા. જ્યારે તેઓની પાછળ નગરપાલિકાના ચીફ ઓફિસર એસ.કે. ગરવાલ સભાખંડ છોડી રહ્યા હતા ત્યારે વિપક્ષી કાઉન્સીલરોએ ભારે હોબાળો મચાવી તેઓને સાંભળવામાં આવે તેવી માંગ સાથે વિરોધ વ્યક્ત કર્યો હતો જે કે કેટલાક કાઉન્સીલરોએ સામાન્ય સભાની ગરિમા ભૂલી જતા ચીફ ઓફિસરનો ઘેરાવો કર્યો હતો.

વડોદરાની વિશ્વામિત્રી બાદ નર્મદા, ઢાઢર, જામ્બવા નદી મગરોનું ઘર

વડોદરા

વડોદરામાં હવે મગરોના વિસ્તારનો વ્યાપ ઝડપભેર વધી રહ્યો છે. મગરો માત્ર વિશ્વામિત્રી નદી પુરતા સિમિત રહ્યા નથી પણ તેમનો વ્યાપ સતત વધી રહ્યો છે. મગરો બંધિયાર પાણીમાં રહેવાનું પસંદ કરતા હોય છે. જેથી વડોદરામાં એક સમય એવો હતો કે મગરો માત્ર આજવા સરોવરમાં જ મોટી સંખ્યામાં જોવા મળતા હતા. પરંતુ વરસાદને કારણે આજવાનું પાણી વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવતું હોવાથી પાણીની સાથે મગરો પણ વડોદરામાં આવવા માંડ્યા હતા. વિશ્વામિત્રી નદીમાં પાંચ વર્ષ

પહેલાં મગરોનો સરવે કરવામાં આવ્યો ત્યારે વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રીમાં વેમાલી થી તલસટ સુધીના અંદાજે ૧૫ કિમી જેટલા વિસ્તારમાં ૨૭૫ મગરો હતા. જેમાં સૌથી વધુ મગરો કાલાઘોડાથી પરશુરામ ભટ્ટા વિસ્તારમાં જોવા મળતા હોય છે. પરંતુ, મગરોનો વ્યાપ હવે વિશ્વામિત્રી નદી પુરતો રહ્યો નથી. મગરો સતત તેમનો વિસ્તાર વધારી રહ્યા છે અને ગામડાંઓમાં પણ રહેણાંક વિસ્તારોમાં મગરો આવી રહ્યા છે. વિશ્વામિત્રી નદી ઢાઢર નદી ને મળતી હોવાથી મગરો ઢાઢર નદી ઉપરાંત જામ્બવા, દેવ નદી અને નર્મદા નદીમાં પણ જોવા મળી રહ્યા છે.

વડોદરા ખાતે પરિણીતાએ સાતમાં માળેથી પડતું મૂકી જીવન ટૂંકાવ્યું

વડોદરા

વડોદરા હરણી વારસિયા રીંગ રોડ સ્થિત સવાદ ક્વાર્ટર્સમાં રહેતી પરણીતા સોમવારે વહેલી સવારે નજીકમાં બંધાતી ઈમારતના સાતમા માળે પહોંચી જઈ પડતું મૂક્યું હતું અને તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. આ યુવતી નું નામ નીતાબેન સોલંકી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે તેમ જ આ યુવતીએ ઘર કંકાશને કારણે પડતું મૂક્યું હોવાનું પણ પોલીસની પ્રાથમિક તપાસમાં જણાઈ

આવ્યું છે. આ બનાવ પગલે સવાદ ક્વોર્ટર્સના રહીશો ને જાણ થતા નવી બંધાતી ઈમારતના સ્થળે દોડી ગયા હતા અને વારસિયા પોલીસને જાણ કરી હતી જે બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી જઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવ થી પરિવારમાં શોકનું વાતાવરણ સર્જાયું હતું. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવાની સાથે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

વડતાલ મંદિરમાં દાગીના ચોરતી 8 મહિલા ઝડપાઈ ગઈ, 1.36 લાખનો મુદ્દામાલ કબજે

મંદિરમાં ભક્તોની ભીડનો લાભ લઈને દાગીના-પર્સની ચોરી કરી મહિલા ભાગી જતી હતી

નડિયાદ

તીર્થધામ વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં ભક્તોની ભીડનો લાભ લઈ કેટલીક મહિલાઓ હરિભક્તોના દાગીના કે પર્સની ચોરી કરી ફરાર થઈ જતી હોવાના તથા પાર્કિંગમાં પાર્ક કરેલા વાહનોની ચોરીના બનાવો બનતા એલ.સી.બી. પોલીસે તપાસ હાથ ધરી હતી.

મંદિરમાં દાગીનાની ચોરી કરતા ઝડપાયેલી મહિલાઓમાં ૧. ગજબેન કાંતિભાઈ ચુનારા (રહે. ઈન્દિરાનગરી નડિયાદ) ૨. સુભાદાબેન ઉર્ફે શોભાબેન ભરતભાઈ દંતાણી (રહે. ઈન્દિરાનગરી નહેર પાસે, નડિયાદ) ૩. મંજુબેન કિશોરભાઈ દંતાણી (રહે. ધંધુકા ઈન્દિરાનગરી નડિયાદ જોગણી માતાજી મંદિર પાસે) ૪. મધુબેન વિજયભાઈ

દંતાણી (રહે. ઈન્દિરાનગરી નડિયાદ પાણીની ટાંકી પાસે) ૫. આશાબેન શંકરભાઈ લસણીયા ૬. ભારતીબેન કાંતિભાઈ લસણીયા ૭. સવિતાબેન ઉર્ફે સેવતાબેન દીપકભાઈ લસણીયા (રહે. ઈન્દિરાનગરી નડિયાદ) ૮. સંગીતાબેન રવિ ઉર્ફે મનોજભાઈ લસણીયા (રહે. ઈન્દિરાનગરી નડિયાદ)નો સમાવેશ થાય છે.

SHARP
INTERNATIONAL
IMMIGRATION SERVICES

CANADA
IMMIGRATION

icrc CRCIC

SPOUSAL SPONSORSHIP
SPECIALIST (98 percent success ratio)

Last minute student admission

Please contact us on

416-745-2466 or 91-9428973911

- Conestoga
- Seneca
- Humber
- Lambton

- Fanshawe
- Georgian
- Algoma
- Canadore

- Algoma
- Saskatchewan polytechnic
- Mohawk

ONLINE IELTS
SPOKEN ENGLISH CLASSES
ON ZOOM

- LMIA/WORK PERMIT • EXPRESS ENTRY
- CANADIAN EXPERIENCE CLASS
- SUPER VISA & VISITOR VISA
- STUDY & WORK PERMIT
- Work / Study /Visitor Permit Extension
- PARENTS/CHILD/SPOUSAL SPONSORSHIP
- REFUGEES/APPEALS /
- DETENTION REVIEWS /
- CRIMINAL PARDONS
- POST GRADUATION WORK PERMIT
- CITIZENSHIP & PR CARD RENEWAL APPLICATIONS

CANADA 94- 499 Main Street South, Shoppers World Mall, Brampton, Ont. Ph : 416-745-2466, 905-230-7855

VADODARA 101-102 Siddharth Complex, Beside Express Hotel, Alkapuri, Vadodara 390007. Ph : 91-94289 73911, 91-95121 57817

AHMEDABAD 139 Iscon Emporio, Beside Star Bazaar Satellite Ahmedabad 380015. Ph : 91-94289 73911, 91-98256 79911

: Specialized in :

Job Offer & LMIA

Entrepreneur

Investor Business

Self Employed

Farm Investor

Email.: info@siis.ca Website.: www.siis.ca



હવે, સ્વદેશ વેબસાઈટના બદલાતા કલેવર

નિહાળો નીત નવા રૂપરંગમાં !!

માત્ર ગરવી ગુજરાત કે મેરા ભારત મહાન જ નહિ પરંતુ સમગ્ર વિશ્વની અટારીએ સર્જાતી અનેકવિધ ઘટનાઓનો સાક્ષાત્કાર ક્ષણેક્ષણ માણો !!
રાજકારણ, સમાજ, ધર્મ, શિક્ષણ, સ્વતંત્રતા, મનોરંજનનો મહાસાગર, હોલીવુડ-બોલીવુડ, પ્રવાસ-પર્યટન, પર્યાવરણ તથા આરોગ્ય વિષયક માહિતીના રોમાંચક ખજાનાનો આવિષ્કાર !!

www.swadesh.news

સ્વદેશમાં વિજ્ઞાપનો માટે ઈમેલ એડ્રેસ પર માહિતી મોકલો

info@swadesh.news

હવે પછી નીચે મુજબના સરનામે તમામ પોસ્ટલ વ્યવહાર કરવા વિનંતી.

23 Lyric Road, Brampton ON L6S 0B4.

શિક્ષણખાતાના ભરતી કૌભાંડમાં પાર્થ ચેટરજીનું નામ નીકળતા મમતાએ મોઢું ફેરવી લીધું

ભ્રષ્ટાચાર: મમતાના વધુ એક મંત્રી EDની ઝપટે

મમતા બેનરજી સરકારના વધુ એક મંત્રી પાર્થ ચેટરજીનો પગ કુંડાળામાં પડ્યો છે. ચેટરજી સામે પશ્ચિમ બંગાળ સ્કૂલ સર્વિસ કમિશન દ્વારા લેવાયેલી ગ્રુપ-સી અને ગ્રુપ-ડીની ભરતીમાં નાણાં લઈને નોકરીઓ આપવાનો ગંભીર આરોપ મુકાયો છે. સીબીઆઈ લાંબા સમયથી આ કૌભાંડની તપાસ કરતી હતી. તેના આધારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ની એન્ટ્રી થઈ અને છેવટે ચેટરજી જેલની હવા ખાતા થઈ ગયા.

ચેટરજી છેક ૨૦૦૧થી બંગાળ વિધાનસભામાં ધારાસભ્ય તરીકે ચૂંટાય છે. ચેટરજી મમતા સરકારમાં મોટું માથું ગણાય અને મમતાના ખાસ ખાસ માણસો પૈકી એક છે. બંગાળના રાજકારણમાં પણ ચેટરજીની ગણના ધુરંધર તરીકે થાય છે. મમતા સરકારમાં હાયર એજ્યુકેશન, ઈન્ફર્મેશન ટેકનોલોજી, ઈન્ડસ્ટ્રી, કોમર્સ જેવાં મલાઈદાર ખાતાના મંત્રીપદે તેઓ રહી ચૂક્યા હોવાથી ચેટરજીની ધરપકડની ઘટના મોટી છે.

સીબીઆઈ સહિતની કેન્દ્રીય એજન્સીઓનો દાવો છે કે, એસએસસીના માધ્યમથી શિક્ષકોની નિમણૂક માટે કરોડો રૂપિયાની લેવડદેવડ કરાઈ હતી. આ કૌભાંડ થયું ત્યારે પાર્થ ચેટરજી શિક્ષણમંત્રી હતા, તેથી તેમણે જ મોટાભાગની મલાઈ ખાધી હોવાનું મનાય છે. આ પ્રકરણમાં ચેટરજીના અર્પિતા મુખરજી અને મોનાલિસા દાસ સાથેના સંબંધો તથા લેવિશ લાઈફસ્ટાઈલની ચર્ચા પણ ઉમેરાય છે. વાસ્તવમાં અર્પિતા મુખરજીના ઘરે ઈડીની રેડ પડી તેમાં જ ચેટરજી ભરવાઈ ગયા. સાઉથ કોલકાતાના એકદમ પોશ મનાતા ડાયમંડ સિટીમાં અર્પિતાના ૨૦૦૦ સ્કવેર ફીટના ફ્લેટમાં દરોડા દરમિયાન જે કંઈ મળ્યું એ જોઈને ઈડીના અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા. આ સમયે અર્પિતાના ઘરમાંથી ૫૦ કરોડ રૂપિયા રોકડા, ૬૫૦ તોલા સોનું, ૫૪ લાખ રૂપિયાની વિદેશી ચલણની નોટો, પોશ વિસ્તારમાં આવેલા ૩ ફ્લેટના દસ્તાવેજ મળી આવ્યા.

બંગાળમાં ચેટરજીની છાપ રંગીલા માણસ તરીકેની છે. અર્પિતા સાથેના તેમના સંબંધો તો ઘણાં સમયથી ચર્ચામાં રહ્યા છે. મધ્યમ વર્ગમાંથી આવતી અર્પિતાના પિતા સરકારી નોકરી કરતા.



અર્પિતા ગ્રેજ્યુએટ થઈ પછી તરત તેના પિતાનું નિધન થતા તેને સરકારી નોકરીની ઓફર થઈ. પરંતુ અર્પિતા અત્યંત મહત્વાકાંક્ષી હોવાથી તેણે સરકારી નોકરીની ઓફર હુકરાવી દીધી. જે બાદ તેણીએ મોડેલિંગ શરૂ કર્યું. કિન્તુ મોડેલિંગમાં તેને બહુ સફળતા ન મળી, જો કે, તેના કારણે તે કોલકાતામાં હાઈ પ્રોફાઈલ લોકોમાં જાણીતી થઈ ગઈ.

પાર્ટીઓની શોપીન અર્પિતા કામ કઢાવવા ગમે તે કરવા તૈયાર થઈ જતી, તેથી તેના ઉચા કોન્ટ્રેક્ટ્સ બનવા માંડ્યા. આવી જ પાર્ટીઓ દરમિયાન ઝારઝામના બિઝનેસમેન સાથે તેનો પરિચય થયો. અર્પિતાના રૂપથી અંજાયેલા બિઝનેસમેને તેની સાથે લગ્ન

પ્રાસંગિક
ધવલ શુક્લ

પૂજા કરતા અને પાણીની જેમ પૈસો વહાવતા. અર્પિતાના રૂપથી અંજાયેલા ચેટરજીએ તેને દુર્ગા પૂજા કમિટીની મોડલ બનાવી દીધી. આખા કોલકાતામાં અર્પિતાનાં મોટાં મોટાં હાર્ડિંગ્સ લગાવી દીધાં અને તે દુર્ગા પૂજાનો ચહેરો બની.

અર્પિતા આ બધું જોઈને ચેટરજીની નાણાંની તાકાતથી પ્રભાવિત થઈ હતી તેથી બંને વચ્ચે સંબંધ બંધાયા કે જે હજુ લગી ટક્યા છે.

અર્પિતા-ચેટરજી પહેલાં ખાનગીમાં મળતાં. રંગીન મિજાજ ચેટરજી નિયમિત રીતે બેંગલોક જતા હોવાનું કહેવાય છે. એ વખતે અર્પિતાને સાથે લઈ જતા. છેલ્લાં ૧૧ વરસથી મમતા સરકારમાં ઈન્ડસ્ટ્રી મિનિસ્ટર હોવાના

11 વર્ષથી ટીએમસી સરકારમાં મહત્વના ખાતા સંભાળતા મંત્રી ચેટરજીની પ્રેમીકાના ઘરેથી ઈડીને કરોડો રોકડા, 650 તોલા સોનું, 54 લાખની વિદેશી ચલણી નોટો તથા 3 ફ્લેટના દસ્તાવેજો મળી આવ્યા

પણ કર્યા પણ લગ્ન બહુ ના ટકતાં અર્પિતા કોલકાતા પાછી આવી ગઈ અને ફિલ્મ-મોડેલિંગ માટે ફરી મથામણ શરૂ કરી. આ વાત ૨૦૦૦ના શરૂઆતનાં વરસોની છે. આ દરમિયાન અર્પિતા ચેટરજીને મળી. ચેટરજી નાકતલા ઉદ્યન સંઘના માધ્યમથી બંગાળમાં સૌથી ભવ્ય દુર્ગા

કારણે ઈન્વેસ્ટર્સ સમિટના નામે ચેટરજી છાસવારે વિદેશ ઉપડી જતા. એ વખતે અર્પિતા પણ તેમની સાથે જ જતી એ વાતની બધાંને ખબર હતી. અર્પિતા-ચેટરજીની આ ખાનગી મુલાકાતો વિશે પહેલાં પણ ઘૂસપૂસ થતી પણ બંને કોઈની પરવા કરતાં ન હતા.

૨૦૧૭માં ચેટરજીનાં પત્નીનું કાર્ડિયાક એરેસ્ટના કારણે મોત થયું પછી તો બંનેને કોઈની શરમ ના રહી. ચેટરજીએ અર્પિતાને ડાયમંડ સિટીમાં લક્ઝરીયસ ફ્લેટ લઈ આપ્યો છે. ચેટરજી અર્પિતાને મળવા ખુલ્લેઆમ ડાયમંડ સિટી જતા અને મોડી રાત સુધી રોકાતા. ચેટરજી અને અર્પિતાની તસવીરો બહાર આવી છે તેમાં પણ બંને પતિ-પત્ની હોય એ રીતે જ ઉભાં છે. એકસરખા કલરનાં ટ્રેડિશનલ બંગાળી કપડાંમાં અર્પિતા-ચેટરજીએ કોઈ પણ પ્રકારની શરમ વિના ફેમિલી આલ્બમ માટે પોઝ આપતા હોય એ રીતે ફોટા પડાવ્યા છે.

ઈડીને પાર્થ ચેટરજીના ઘરેથી એક ડાયરી મળી આવી હતી, જેમાં અર્પિતા મુખરજીના ઘરેથી મળી આવેલા કાળાં નાણાંનો હિસાબ રાખવામાં આવ્યો હતો. ઈડી દ્વારા પાર્થ ચેટરજીની અને અર્પિતા મુખરજીની ધરપકડ કરવામાં આવી છે. શિક્ષક ભરતી કૌભાંડમાં સંડોવાયેલા પાર્થ ચેટરજી અગાઉ ૩,૦૦૦ કરોડ રૂપિયાના આઈ-કોર ચીટ ફંડ કૌભાંડમાં પણ સંડોવાયેલા હતા. પાર્થ ચેટરજી ૨૦૨૧માં વિધાનસભાની ચૂંટણી લડ્યા ત્યારે તેમણે કુલ ૧.૧૫ કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી હતી. પાર્થ બેનરજી ૨૦૧૧ માં ચૂંટણી લડ્યા ત્યારે તેમણે ૭.૮ લાખ રૂપિયાની સંપત્તિ જાહેર કરી હતી. આ મિલકત ૨૦૧૬ માં વધીને ૮૦ લાખ પર અને ૨૦૨૧ માં ૧.૧૫ કરોડ રૂપિયા પર પહોંચી ગઈ હતી. દસ વર્ષના ગાળામાં જ તેમની સત્તાવાર સંપત્તિમાં પંદર ગણા જેટલો ચમત્કારિક વધારો થયો છે. અર્પિતા-ચેટરજીની સ્ટોરી આખા દેશમાં ગાજી રહી છે ત્યારે ચેટરજીની ધરપકડ થયા પછી મમતા બેનરજીએ પોતાનો રાગ બદલી કાઢ્યો છે. અગાઉ તેઓ કેન્દ્ર સરકાર પર આક્ષેપો કરતા હતા કે તે વિરોધ પક્ષના નેતાઓને હેરાન કરવા માટે સેન્ટ્રલ એજન્સીઓનો દુરુપયોગ કરે છે. પાર્થ ચેટરજીની ધરપકડ પછી તેમણે તેમનો બચાવ કરવાનો જરાય પ્રયાસ નથી કર્યો, પણ જાહેરમાં કહ્યું છે કે, જો તેમણે ભ્રષ્ટાચાર કર્યો હોય તો તેમને કડકમાં કડક સજા થવી જોઈએ. આ સાથે મમતાએ ગુરુવારે ચેટરજીને મંત્રીપદમાંથી હટાવી દીધા હતા.



53 વર્ષીય જેનિફ લોપેઝે ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું

અભિનેતા રણવીરસિંહ બાદ હવે વધુ એક અભિનેત્રીની નગ્ન તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલી છે. સિંગર-અભિનેત્રી જેનિફ લોપેઝે તેના ૫૩મો વર્ષીય પર ન્યૂડ તસવીરો સાથે ચાહકોને ચોંકાવી દીધા છે. હોલિવૂડ સુપરસ્ટાર જેનિફ લોપેઝે તાજેતરમાં તેનો 53મો ૫૩મો વર્ષીય ઉજવ્યો હતો. આ દિવસે તેણે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની નગ્ન તસવીરો શેર કરી હતી. જેનિફે તેની ઇન્સ્ટા સ્ટોરી અને એક વીડિયોના થંબનેલમાં તેના નગ્ન ફેટા મૂક્યા છે. જો કે, તેના ચાહકો રણવીરસિંહના ફેટાની તુલનામાં જેનિફ લોપેઝેની તસવીરો પર તેના ખેરદાર વખાણ કરી રહ્યા છે. જેનિફને ટ્રોલ કરવામાં આવી નથી.



સ્પર્દા

FRIDAY, 29 JULY, 2022

09

બોલીવૂડની નવી પેઢીની સૌથી હોટ જોડી દિશા-ટાઈગરનું બ્રેકઅપ



મુંબઈ: બોલીવૂડની નવી પેઢીના એક્ટર્સમાં સૌથી હોટ અને કન્ફર્મ જોડી મનાતાં ટાઈગર શ્રોક અને દિશા પટાણી છ વર્ષનાં રેલેશન પછી છૂટાં પડી ગયાં છે. આ સમાચાર બાદ તેમના ચાહકો આઘાતમાં ગરકાવ થઈ ગયા છે. બંનેના સંબંધો એટલા પ્રગાઢ હતા કે તેમનાં લગ્ન નિશ્ચિત મનાતાં હતાં. ત્યાં બ્રેક અપના સમાચારથી ચાહકોનાં પણ દિલ તૂટી ગયાં છે. ટાઈગર અને દિશાએ ૨૦૧૮ની બાગી ટુ અને બેફિક્કરા તેમજ મ્યુઝિક વીડિયોસમાં સાથે કામ કર્યું હતું. દિશાએ ટાઈગરની બાગી ૩માં એક વિશેષ સોંગ પણ કર્યું હતું. દિશા અને ટાઈગરે જોકે, ક્યારેય તેમના સંબંધો ઓફિશિયલ કર્યા ન હતા. પરંતુ માલદિવની ટૂર્સથી માંડીને મુંબઈમાં સાથે આઉટિંગ અને એકબીજાના ઘરે લાંબા સમય સુધી વસવાટ સહિતની બાબતો તેમના પ્રેમ સંબંધોની સાક્ષી પૂરતાં હતાં.



સોનાક્ષીનો હોમ પ્રોજેક્ટ: ભાઈ દિગ્દર્શન કરશે અને પોતે એક્ટિંગ

મુંબઈ : શત્રુઘ્ન સિંહાનો પુત્ર કુશ સિંહા ફિલ્મ દિગ્દર્શનમાં ડેબ્યુ કરી રહ્યો છે. તેની બહેન સોનાક્ષી જ આ ફિલ્મમાં લીડ રોલ ભજવવાની છે. નિકિતા રોય એન્ડ ધી બૂક ઓફ ડાર્કનેસ નામની આ ફિલ્મમાં કુશ દિગ્દર્શક અને સોનાક્ષી આ ફિલ્મના અન્ય કલાકારોમાં પરેશ રાવલ તથા સુહેલ નાયરનો સમાવેશ થાય છે. સોનાક્ષીના અનુસાર બહુ લાંબા સમયથી તે અને કુશ કોઈ પ્રોજેક્ટ માટે કોલબરેશન કરવાં હતાં. છેવટે અમને એક એવી સ્ટોરી મળી છે જેના માટે અમે બંને સંમત થયાં જોકે, આ ફિલ્મની કથા કે અન્ય પાસાં વિશે તેમણે કોઈ માહિતી આપી નથી. આ ફિલ્મ આવતાં વર્ષે રિલીઝ થાય તેવી ધારણા છે. સોનાક્ષીની છેલ્લી ફિલ્મ ભૂજ ધી પ્રાઈડ ઓફ ઈન્ડિયા ગયાં વર્ષે લોકડાઉનના કારણે સીધી ઓટીટી પર રિલીઝ થઈ હતી. તે પહેલાં ૨૦૧૯માં તે દબંગ ૩માં મોટી સ્ક્રીન પર દેખાઈ હતી.



રશ્મિકા મંદાના ગુડબાય ફિલ્મથી બોલીવૂડમાં ડેબ્યુ કરશે

સાઉથ ઈન્ડસ્ટ્રીની અભિનેત્રી રશ્મિકા મંદાના બોલીવૂડમાં ડેબ્યુ કરવાની છે. તે ગુડબાય ફિલ્મથી અમિતાભ બચ્ચન સાથે કામ કરીને હિંદી ફિલ્મોમાં પોતાની અભિનય ક્ષમતા પુરવાર કરવાની તૈયારીમાં છે. જોકે તેણે મિશન મજનુમાં પણ કામ કર્યું છે. પરંતુ ગુડબાય ફિલ્મની રિલીઝ ડેટની ઘોષણા થતાં જ તેની બોલવૂડ ડેબ્યુ ફિલ્મ ગુડબાય ફિલ્મ હશે. ગુડબાય ફિલ્મની રિલીઝની ઘોષણાની તારીખ ૭ ઓક્ટોબર ૨૦૨૨ની થઈ છે. આ ફિલ્મની વાર્તા પરિવાર અને સંબંધોની આસપાસ ફરતી જોવા મળશે, જે હૃદયસ્પર્શી હશે. આ ફિલ્મમાં સેવેદનશીલતાની સાથે કોમેડી પણ હશે. રશ્મિકા મંદાના હાલ દિલ્હી એક ફિલ્મના શૂટિંગ માટે ગઈ હતી ત્યારે દિલ્હી શહેરથી પ્રભાવિત થઈ ગઈ હતી. ત્યાંની વાનગીઓ અને શહેરની લોકપ્રિય ઈમારતો જોઈને તે ખુશ થઈ હતી.



જહાન્વી કપૂર ગણિત વિષયના પોતાના વિચારો અંગે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ

બોલીવૂડ સેલિબ્રિટીસ અવાર-નવાર સોશિયલ મીડિયા પર પોતાના વિચારો વ્યક્ત કરતી વખતે ટ્રોલ થતી જોવા મળે છે. હાલ જહાન્વી કપૂરને પણ ગણિત વિષય બદલ પોતાના વિચારો સ્પષ્ટ કરતાં ટ્રોલ કરવામાં આવી છે. આ પહેલા આલિયા ભટ્ટ અને અનન્યા પાંડે પણ સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ છે. જહાન્વી હાલ પોતાની આવનારી ફિલ્મ ગુડ લકી જેરીના પ્રમોશનમાં વ્યસ્ત છે. ત્યારે તેને સોશિયલ મીડિયા પર ટ્રોલરોનો સામનો કરવો પડ્યો છે. તેણે એક ઈન્ટરવ્યુ દરમિયાન ગણિત વિષય મંદબુદ્ધિ કરનારું છે, જે સાંભળતા જ સોશિયલ મીડિયા યુઝર્સ તેને ટ્રોલ કરી છે. જહાન્વીએ એક ઈવેન્ટ દરમિયાન પોતાના શિક્ષણના દિવસોની યાદ તાજ કરતાં કહ્યું કે, મને ઈતિહાસ અને ભાષામાં જ વધુ રસ હતો અને એમાં હું સારી પણ હતી. મેં અત્યાર સુધીમાં મારા અંગત જીવનમાં એલજીબ્રા ગણિતનો ઉપયોગ જ નથી કર્યો તો પછી તેના પાછળ શું કામ મેં માથાફોડી કરી હતી. કેલક્યુલેશન ઉપયોગ પછી એલજીબ્રાનો ઉપયોગ જ નથી કર્યો. ઈતિહાસ અને લિટરેચરની વાત જ અલગ છે. ગણિત તો તમને મંદબુદ્ધિ બનાવે છે.

સામંથા અને અક્ષય કુમાર ફિલ્મ પડદે પણ જોડી જમાવે તેવી અટકળો

સાઉથની ટોચની હિરોઈન સામંથાને બોલીવૂડમાં એક પછી એક ફિલ્મો મળી રહી છે. હવે તેને કરણ જોહરે પણ અક્ષય કુમાર સામેની એક ફિલ્મમાં સાઈન કરી હોવાની ચર્ચા છે. વાસ્તવમાં કરણ જોહરે સામંથા અને અક્ષયને એક ટોક શોમાં સાથે રાખ્યાં ત્યારે જ લોકોને નવાઈ લાગી હતી કે સામંથા અને અક્ષયની જોડી કેમ પસંદ કરવામાં આવી હશે. પરંતુ, જાતભાતના માર્કેટિંગ ગીમીક માટે જાણીતા કરણ જોહરે જાણી બુઝીને પોતાની આગામી ફિલ્મના કો સ્ટાર્સને એક ચેટ શોમાં સાથે રાખ્યાં નું હવે બહાર આવ્યું છે. સામંથાને હિંદીના દર્શકોએ પુષ્પાના અંટવા આઈટમ સોંગ ઉપરાંત ફેમિલી મેન સિરીઝ દ્વારા જ જોઈ છે. જોકે, તે પછી તેની લોકપ્રિયતા વધતી ગઈ છે. આ ટોક શોમાં પણ સામંથાએ જે રીતે જવાબો આપ્યા અને ખાસ તો પોતાના



નાગા ચૈતન્ય સાથેના છૂટાછેડા અંગે તથા અક્ષય સામે પોતાને મળતી ફી અંગે નિખાલસ તથા બોલડ વાતો કરી તે પછી તેના ચાહકોની સંખ્યા વધી ગઈ છે. બોલીવૂડમાં સામંથાને એક પછી એક ફિલ્મો મળી રહી છે.

શ્રેયસ તળપદે સ્ક્રીન ઉપર અટલ બિહારી વાજપેયીને સજીવન કરશે



મુંબઈ : કંગના રણૌતની ફિલ્મ ઈમરજન્સીમાં અટલ બિહારી વાજપેયીનું પાત્ર તેજસ્વી અભિનેતા શ્રેયસ તળપદે ભજવશે એવી જાહેરાત થઈ છે. આ ફિલ્મ ૧૯૭૫માં દેશમાં લદાયેલી કટોકટી આસપાસની ઘટનાઓ આધારિત છે. કંગના ખુદ ઈન્દિરા ગાંધીની ભૂમિકા ભજવી રહી છે. થોડા દિવસો પહેલાં જાહેરાત થઈ છે કે અનુપમ ખેર જયપ્રકાશ નારાયણનું પાત્ર ભજવવાના છે. હવે એ સમયગાળામાં દેશના રાજકીય સેન્ટર સ્ટેજ પર રહેલા અટલ બિહારી વાજપેયીની ભૂમિકા શ્રેયસ તળપદેને સોંપાઈ છે. શ્રેયસ તળપદે આજના સમયમાં ફિલ્મ ઉદ્યોગના સૌથી પ્રતિભાશાળી કલાકારમાં ગણાય છે. ઓમ શાંતિ ઓમ જેવી કોમર્શિઅલ ફિલ્મથી માંડીને ડોર અને ઈકબાલ જેવી મુખ્ય ધારાથી અલગ પ્રકારની ફિલ્મ કે પછી કોમેડી ફિલ્મોમાં પણ તેણે પોતાની ક્ષમતા પુરવાર કરી છે. મુત્સદી છતાં સુકોમળ કવિજીવ એવા વાજપેયીની ભૂમિકા કોઈ પણ અભિનેતા માટે પડકારજનક છે. તેમની વિશિષ્ટ વક્રત્વ શૈલી લોકોના દિલોદિમાગ પર અંકિત છે. શ્રેયસ સામે એ અદભૂત કથનને જીવંત કરવાનો પડકાર છે. શ્રેયસે પોતાને આ ભૂમિકા મળી તેનો રાજીપો વ્યક્ત કર્યો છે અને આ તક આપવા માટે કંગનાનો આભાર માન્યો છે. કંગના ખુદ આ ફિલ્મની નિર્માતા અને દિગ્દર્શક પણ છે.



ઉ. પ્રદેશમાં વીજળીથી 20ના મોત, રાજસ્થાનમાં પૂર

વાદળ ફાટતા અટકાવાયેલી અમરનાથ યાત્રા ફરી શરૂ : દેશભરમાં વીજળી પડવાથી આશરે 50ના મોત, હિમાચલમાં પૂરમાં અનેક વાહનો ફસાયા

નવી દિલ્હી

અનેક રાજ્યોમાં હાલ ભારેથી અતી ભારે વરસાદ પડી રહ્યો છે. જેને પગલે વિજળી પડવાની ઘટના પણ વધવા લાગી છે. અગાઉ બિહારમાં વિજળી પડવાથી ૨૦થી વધુ લોકો એક જ દિવસમાં માર્યા ગયા ત્યારે હવે ઉત્તર પ્રદેશમાં પણ વિજળી પડવાની ઘટનામાં ૨૦ લોકો માર્યા ગયા છે. જેને પગલે છેલ્લા ૨૪ કલાકમાં દેશભરમાં વિજળી પડવાની ઘટનામાં ૫૦થી વધુ લોકો માર્યા ગયા છે.

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ, કૌશંબી, ગાઝિપુર, ભાદોડીમાં સૌથી વધુ વિજળી પડવાની ઘટના સામે આવી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દુઃખ વ્યક્ત કર્યું હતું

અને માર્યા ગયેલાના પરિવારને ચાર લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી. જ્યારે હિમાચલ પ્રદેશમાં લાહૌલ સ્થિતિમાં અત્યંત ભારે વરસાદને કારણે રોડ બંધ થઈ ગયા હતા. જેથી ૪૦થી વધુ વાહનો ફસાઈ ગયા હતા. જે પણ લોકો આ પૂરમાં ફસાયા છે તેમને રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યા છે.

રાજસ્થાનમાં પણ સતત બીજા દિવસે પૂરની સ્થિતિ સર્જાઈ હતી. પશ્ચિમ રાજસ્થાનમાં સ્થિતિ વધુ કફોડી છે. ખાસ કરીને જોધપુરમાં અનેક ઘરોમાં પાણી ભરાયા હતા. જેને પગલે અહીંની સ્કૂલ-કોલેજોને બંધ કરી દેવાઈ છે. જ્યારે ચાર ટ્રેનો રદ કરાઈ હતી અને પાંચને ડાયવર્ટ કરવામાં આવી હતી.



હની ટ્રેપમાં ફસાવી ઈન્ડિયન આર્મીને પાકિસ્તાની જાસૂસોએ માહિતી કઠાવી સ્વરૂપવાન યુવતીઓએ વોટ્સએપથી જાળ બિલાવી

જયપુર

ભારતીય સૈન્યમાં જાસૂસી સાથે જોડાયેલો મામલો સામે આવ્યો છે. રાજસ્થાનમાં તેનાત સૈન્યના એક જવાનને પાકિસ્તાનની બે યુવતીએ હની ટ્રેપમાં ફસાવ્યો હતો જે બાદ આ જવાન પાસેથી આ જાસૂસ મહિલાએ સૈન્યની ગુપ્ત માહિતીઓ કઠાવી લીધી હતી. હાલ આ જવાનની ધરપકડ કરીને પૂછપરછ કરાઈ રહી છે.

સૈન્યના એક ૨૪ વર્ષીય જવાન શાંતિમય રાણાની આ મામલે રાજસ્થાન પોલીસની ઈંટેલિજન્સ વિંગ

દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જવાન પર જાસૂસી અને પાકિસ્તાની એજન્ટને ગુપ્ત માહિતી લીક કરવાનો આરોપ છે. આ જવાન પશ્ચિમ બંગાળના બાગુંડા જિલ્લાના એક ગામનો રહેવાસી છે. અને હાલ તે જયપુરમાં અર્ટલરી યુનિટમાં સેવા આપી રહ્યો હતો. રાજસ્થાન પોલીસની ઈંટેલિજન્સ વિંગના ડાયરેક્ટર જનરલ ઉમેશ મિશ્રાએ જણાવ્યું હતું કે પાકિસ્તાની એજન્ટ ગુરનૌર ઉર્ફે અંકિતા અને નિશાએ આ જવાનનો સોશિયલ મીડિયા દ્વારા સંપર્ક કર્યો હતો.

કર્ણાટકમાં 32 વર્ષીય ભાજપ નેતાની કુહાડી મારી હત્યા બાદ વિરોધ પ્રદર્શન આ જઘન્ય કૃત્યમાં સામેલ આરોપીઓની જલ્દી ધરપકડ કરવાની ખાતરી

નવી દિલ્હી

કર્ણાટકના બેલ્લારેમાં BJP નેતાની હત્યા કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીના 32 વર્ષીય યુવા મોર્યા નેતા પ્રવીણ નેતારુની હત્યા બાદ સુલિયા તાલુકો બેલ્લારેમાં અને અન્ય વિસ્તારમાં પણ તનાવની સ્થિતિ છે. પ્રવીણ મંગળવારે રાતે પોતાની દુકાનથી ઘેર જઈ રહ્યાં હતા, ત્યારે તેમના પણ જીવલેણ હુમલો કરવામાં આવ્યો જેમાં તેમનું મોત થયું હતું.

બેલ્લારે વિસ્તારની પાસે પોલ્ટ્રીની દુકાન ચલાવનારા પ્રવીણ નેતારુ જ્યારે ઘરે જઈ રહ્યાં હતા, ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં હમલાવર બાઈકથી આવ્યા હતા અને કુહાડી દ્વારા હુમલો કરીને આ હત્યાને અંજામ આપ્યો હતો. આ હત્યાનું કારણ પોલીસને જાણવા



મળ્યું નથી. પોલીસ જ્યારે ઘટના સ્થળ પર પહોંચી ત્યારે પ્રવીણ નેતારુને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા જ્યાં ડોક્ટરે તેમને મૃત ઘોષિત કર્યા હતા. આ ઘટનાને લઈને મુખ્યમંત્રી બોમ્મઈએ બુધવારે આશ્વાસન આપ્યું કે, આ જઘન્ય કૃત્યમાં શામિલ દોષિઓની જલ્દી જ ધરપકડ કરવામાં આવશે.

ઝારખંડમાં હાથીએ દંપતીને કચડી નાંખ્યું ઘરોમાં તોડફોડ કરી અનાજ સાફ કરી નાંખ્યું

હાથીઓને હવે ભગાડવા માટે વન વિભાગના અનેક અધિકારીઓ કામગીરીમાં લાગ્યા

નવી દિલ્હી

ઝારખંડ રાજ્યમાં આજકાલ હાથીઓએ મચાવેલા હાહાકારની ચર્ચા છે. રાજ્યના સંખ્યાબંધ વિસ્તારમાં ગજરાજો વિક્ર્યા છે અને લેટેસ્ટ મામલામાં હજારીબાગ જિલ્લામાં હાથીઓએ કહેર વરતાવ્યો છે. હાથીઓના ઝુંડ ઇશવારે નિકળી પડે છે અને ગામડાઓમાં ઘુસી જાય છે. માટેલા હાથીઓએ સેંકડો ઘર તોડી નાંખ્યા છે અને ઘરમાં મુકેલુ અનાજનો પણ સફાવ્યો



કરી નાંખ્યો છે. હાથીઓના ઉપદ્રવથી લોકો ભયભીત થઈ ગયા છે. વન વિભાગ એક્શનમાં આવ્યો

છે અને અધિકારીઓ ગામડાઓમાં પહોંચી રહ્યા છે. હાથીઓ અનાજ ખાઈ ગયા બાદ લોકોને ચિંતા છે કે, અમારૂં પેટ કેવી રીતે ભરાશે..હાથીઓના આ ટોળામાં 10 થી 15 હાથી છે જે ઇશવારે ગામડાઓમાં ઘુસી આવે છે. હજારીબાગ જિલ્લામાં હાથીઓએ લોકો પર પણ હુમલો કર્યો હતો અને તેમાં એક દંપતિનું મોત પણ થયું હતું. હાથીઓને હવે ભગાડવા માટે વન વિભાગના અધિકારીઓ કાર્યવાહી કરી રહ્યા છે.

TMCના 38 ધારાસભ્ય ભાજપમાં સંપર્કમાં હોવાનો મિથુનનો દાવો

કોલકાતા

અભિનેતામાંથી નેતા બનેલા મિથુન ચક્રવર્તીએ દાવો કર્યો છે કે તૃણમુલ કોંગ્રેસના ૩૮ ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે. ઉલ્લેખનીય છે કે અભિનેતા ગયા વર્ષે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી અગાઉ ભાજપમાં જોડાયા હતાં. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ૩૮માંથી ૨૧ સીધા જ મારા સંપર્કમાં છે. પત્રકાર પરિષદને સંબોધતા મિથુન ચક્રવર્તીએ જણાવ્યું હતું કે તૃણમુલ કોંગ્રેસના ૩૮ ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે. જે પૈકી ૨૧ ધારાસભ્યો સીધા જ મારા સંપર્કમાં છે.

બીજી તરફ તૃણમુલ કોંગ્રેસે મિથુન ચક્રવર્તીના આ દાવાને ફગાવી દેતા જણાવ્યું હતું કે અભિનેતા ખોટા દાવાઓ કરીને લોકોને મૂર્ખ બનાવવાના પ્રયત્નો કરી રહ્યાં છે.

ચક્રવર્તીએ વધુમાં જણાવ્યું હતું કે દેશના ૧૮ રાજ્યોમાં ભાજપ સત્તામાં છે અને અન્ય કેટલાક રાજ્યોમાં પણ ટૂંક સમયમાં ભાજપ સત્તા પ્રાપ્ત કરશે. પશ્ચિમ બંગાળમાં ભાજપ પોતાની લડાઈ બંધ કરશે નહીં. જો આજની તારીખે મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી કરાવવામાં આવે તો ભાજપ સરકારની રચના કરી શકે છે.

નવા રાષ્ટ્રપતિ મુદ્દે લોકસભા ચેમ્બરમાં સોનિયા ગાંધી અને સ્મૃતિ ઈરાની વચ્ચે તરકાર

લખનઉ

કોંગ્રેસી નેતા અધીર રંજન ચૌધરીએ દેશના નવનિયુક્ત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિની કહ્યા તેને લઈને ભારે હોબાળો મચી ગયો છે. ભાજપે આરોપ લગાવ્યો છે કે વિરોધ પક્ષ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું અપમાન કરી રહ્યો છે અને માંગણી કરી છે કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ દેશની માફી માંગવી જોઈએ. પોતાના બચાવમાં લોકસભામાં કોંગ્રેસના નેતા ચૌધરીએ કહ્યું હતું કે, તેમનો ઈરાદો રાષ્ટ્રપતિનું અપમાન કરવાનો ન હતો અને તેમણે ભૂલથી આવું કહ્યું હતું. તેમણે ભાજપ પર આક્ષેપ કરતા કહ્યું હતું કે, ભાજપ આ મુદ્દે રાઈનો પર્વત બનાવી રહી છે. જોકે, ભાજપ આ મુદ્દે કોંગ્રેસ સામે આક્રમક બની છે.

કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં લેવાયેલો નિર્ણય બીએસએનએલને ફરી બેઠી કરવા 1.64 લાખ કરોડના પેકેજને મંજૂરી

નવી દિલ્હી

કેન્દ્રીય કેબિનેટે સરકારી ટેલિકોમ કંપની બીએસએનએલને પુનર્જીવિત કરવા માટે ૧.૬૪ લાખ કરોડ રૂપિયાના પેકેજને મંજૂરી આપી છે તેમ ટેલિકોમ પ્રધાન અશ્વિની વૈશ્ણવે જણાવ્યું છે. પેકેજના ત્રણ ભાગ છે. સેવાઓમાં સુધાર, બેલેન્સશીટ મજબૂત બનાવવી અને ફાઈબર નેટવર્કનું વિસ્તાર.

ટેલિકોમ પ્રધાન અશ્વિની વૈશ્ણવે કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા લેવામાં આવેલા નિર્ણયો

અંગે પત્રકારોને જણાવ્યું હતું કે સરકાર બીએસએનએલને ફોર-જી સેવા શરૂ કરવા માટે સ્પેક્ટ્રમની ફાળવણી કરશે. પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે કેબિનેટ દ્વારા મંજૂર કરવામાં આવેલા પેકેજમાં ૪૩,૯૬૪ કરોડ રૂપિયા રોકડ અને ૧.૨ લાખ કરોડ રૂપિયા બિન રોકડ સ્વરૂપમાં આગામી ચાર વર્ષમાં આપવામાં આવશે. ટેલિકોમ પ્રધાને આપેલી માહિતી મુજબ બીબીએનએલને બીએસએનએલ સાથે મર્જ કરવામાં આવશે.

મધ્યપ્રદેશમાં લાકડા વીણવા માટે ગયેલી મહિલાને 20 લાખનો હીરો મળી આવ્યો

પણા

મધ્યપ્રદેશના પત્તા જિલ્લામાં લોકોનું નસીબ બદલાતા વાર નથી લાગતી. ત્યાં ચાલતા ચાલતા જતાં પણ કેટલીક વખત હીરો મળી આવ્યો હોવાની ઘટનાઓ નોંધાઈ છે. આવી જ એક ઘટના ત્યાંની એક ગરીબ મહિલા સાથે બની છે. આ ગરીબ મહિલા લાકડા વીણવા માટે જંગલમાં જઈ રહી હતી ત્યારે તેને રસ્તામાંથી ૪.૩૮ કેરેટનો હીરો નીચે જમીન પર પડેલો મળી આવ્યો. આ હીરાની કિંમત લાખો રૂપિયામાં છે. હીરો મળી આવતા આ મહિલાનું નસીબ ચમકી ગયું છે. જે હીરા કાર્યાલયમાં જમા કરાવાયો છે. આ હીરાની અંદાજિત કિંમત ૨૦ લાખ રૂપિયા છે. હીરા કાર્યાલયના અધિકારીએ આ જાણકારી આપી છે.



વિક્રમ હું US આવું છું, શિકાગો એરપોર્ટ પર લેવા આવજે

નિઓન-સાઈન લાઈટ માટે જગવિખ્યાત એવા લાસવેગાસ (અમેરિકા)થી રેખાનો પત્ર હતો. એણે લખ્યું હતું, 'તમને પત્ર વાંચીને જરા નવાઈ લાગશે. મારો સંપર્ક તમારી સાથે ઘણાં વર્ષોથી નથી. પણ તમારો ખ્યાલ હું ઘણીવાર કરતી અને વિચારતી કે તમે ક્યાં હશો? ગુજરાતી ભાષા બોલવાનો મારો મહાવરો નથી અને અંગ્રેજીની જાણે કે આદત જ પડી ગઈ છે. મારી ડાયરીનાં પાનાં આજે ફેરવતી હતી. બસ, તમે યાદ આવી ગયા. થયું કે લાવ તમને પત્ર લખું. હું જ્યારે એસએસસીનું પરિણામ જાણવા ઈન્ટેજરમાં હતી એ વખતે મેં મારું રિઝલ્ટ જાણવા તમારા અખબારની કચેરીએ ફોન કર્યો હતો. તમે મને પરિણામ જણાવ્યું હતું. મને ફર્સ્ટ ક્લાસ ના મળતાં હું જરાક નિરાશ થઈ ગયેલી. તમે મને થોડીક સ્વીટ્સ આપીને પ્રોત્સાહન આપેલું કે હવે કોલેજમાં સખત મહેનત કરજે. યાદ છે તમને? તમે મને ઓળખી? હું આનલની નાની બહેન રેખા. હવે ઓળખાણ પડી? આનલ જ્યારે અમદાવાદમાં હતી ત્યારે એને તો તમારા માટે કેટલું બધું માન હતું? તમારી વાતાઓ તે વાંચતી. ઘેર પણ આખો દિવસ બસ એ તમારી જ વાતો કર્યા કરતી. તમને

પણ કેટલું બધું વહાલ હતું એના માટે! યાદ આવે છે એ આનલ. તમારી ફેન્ડ - આનલ. મારી બહેન આનલ. વિક્રમની પત્ની આનલ. અને... તમે જાણો છો આપણી આનલ આજે ક્યાં છે? કેવી છે? શું કરે છે? તમે તો કદાચ ભૂલી ગયા હશો પણ આનલ તમને નહીં ભૂલી હોય. એ જ્યાં પણ છે ત્યાં રહીને પણ એ તમને યાદ કરતી જ હશે. પણ આનલ પર શું શું વીત્યું એની તમને ખબર છે? લ્યો આ રહી આનલની વાત. થોડાંક વર્ષો પહેલાંની વાત છે. આનલ તો અમદાવાદની જ છોકરી. શહેરની કોલેજમાં ભણેલી એ મુઘા. જેટલી રૂપાળી એટલી જ લાગણીશીલ. એની આંખોમાં કદીક શાંત સાગરની મંદ મંદ લહેરખીઓ લહેરાય તો કદીક પર્વત પરથી પીણમાં ધસમસતી નદીના વિશાળ જળરાશિની પ્રચંડ ગર્જનાઓ પણ દેખાય. એના મનમાં અનેક રંગબેરંગી સપનાં હતાં. રૂડા-રૂપાળા સંસારની તેને એક આગવી કલ્પના હતી. તે માટે એના પોતાના કેટલાક મનોરથ હતા. આનલ ઉમરલાયક થતાં એના માટે એના જ જેવા સુંદર વરની શોધ કરવામાં

આવી. એવામાં એક સોહામણો યુવક અમેરિકાથી માત્ર બે અઠવાડિયાં માટે જ અમદાવાદ આવેલો હતો. એનું નામ વિક્રમ. જોવાય એટલું જોયું. વિક્રમે પણ જે પૂછવું હતું તે પૂછ્યું. બંનેને એકબીજા માટે લાગણી હતી. કુટુંબોની તો સંમતિ હતી જ. અમેરિકાથી થોડોક સમય બંને અમદાવાદમાં જ સાથે રહ્યાં. થોડોક સમય તેઓ અહીંતહીં ફરી આવ્યાં. આનલને પણ જેવો જોઈતો હતો તેવો વર મળી ગયાનો સૌને સંતોષ હતો. આનલની આંખોમાં પણ સંતુષ્ટિનું એ કિરણ જોઈ શકાતું. અને પછી સમય પૂરો થતાં વિક્રમને અમેરિકા પાછા જવાનો દિવસ આવી ગયો. વિક્રમે જતાં જતાં કહ્યું હતું, 'આનલ! હું પહોંચીને તરત જ તને પત્ર લખીશ. તારા વિગા માટેના પેપર્સ પણ હું તૈયાર કરી લઈશ. તું જલદી જલદી અમેરિકા આવી જવાની તૈયારી રાખજે. તું પણ મને પત્ર લખજે.' અને આનલ છેક એરપોર્ટ સુધી વિક્રમને વળાવવા ગઈ હતી. વિક્રમ એરપોર્ટ પરની માનવભીડમાં અદૃશ્ય થયો ત્યાં સુધી એ જોઈ રહી. પ્લેન - અવકાશમાં ગરકાવ થયું ત્યાં સુધી તે એના વિક્રમને લઈ જતા હવાઈ જહાજને હુ નીરખી રહી. આનલ ઘેર પાછી આવી અને કેટલીયે વાર સુધી એકલી જ એના પલંગમાં ઓશીકામાં મોં છુપાવીને પડી રહી. કેટલાયે દિવસો સુધી તે સૂનમૂન રહી. 4. એની નજર આગળથી વિક્રમ ખસતો નહોતો.

પછી તો એણે દિવસો ગણવા માંડ્યા, 'વિક્રમ અમેરિકા જઈ બીજા જ દિવસે મને પત્ર લખે તો એ પત્ર આવતાં આઠથી દસ દિવસ લાગે.' આનલ આઠ દિવસ બાદ વિક્રમના પત્રની રાહ જોવા લાગી. આઠમો દિવસ, નવમો દિવસ, દસમો દિવસ. ટપાલી આવે. પપ્પાના બીજા પત્રો આવે પણ આનલ માટે કોઈ પત્ર નહીં. 'હશે... એ તો બિચારો થાકી ગયો હતો. જઈને તરત જ એ કેવી રીતે પત્ર લખે? બે-ચાર દિવસ પછી પત્ર લખે તો મારે હજી બીજા બે-ચાર દિવસ વધુ રાહ જોવી રહી.' એમ વિચારી આનલ મન મનાવે. પણ વિક્રમનો પત્ર ના આવ્યો તે ના જ આવ્યો. મહિનો વીત્યો તો એ પત્ર ના આવ્યો. મહિનાઓ વીત્યા તો એ પત્ર ના આવ્યો. આનલ તો શું પણ ઘરનાં એ સૌ વિચારમાં પડી ગયાં કે એકાએક આમ કેમ બન્યું? છેવટે નિર્ણય એવો લેવાયો કે ખુદ આનલે જ વિક્રમને પત્ર લખવો. (કમશ આવતાં અંકે)



કમર જહાં

કેવેન્ડ્ર પટેલ

કેવેન્ડ્ર પટેલ
સંપર્ક
+91 98792 07102

॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી લેખમાળા

બોલવામાં સંયમ આવે તો જીવનભર પસ્તાવું ન પડે

બહુ દૂરની નહીં, ૭૦-૮૦ વર્ષ પહેલાંની આ વાત હશે. એક હતો લવજી. બધા પ્રેમથી તેને 'લવિયો' કહીને બોલાવે. સિલાઈકામ કરનાર આ યુવાને પોતાની કળા-કારિગરીથી ગામમાં બધાનું દિલ જીતી લીધું હતું. લવિયો ઉમરલાયક થતા તેના લગ્ન થયા. પહેલેથી લવિયો રિંગણનો રસિયો. 'રિંગણું' નામ પડે અને લવિયાના મોઢામાં પાણી ન છૂટે - સીધો ગંગાનો પ્રવાહ વછૂટે! તે વારે-વારે તેની નવી આવેલી પત્નીને કહેતો : 'તારા હાથે ભરેલા રિંગણાંનું શાક ખાવું છે.' એકવાર લવિયો દુકાને સંચો ચલાવતો હતો, ત્યાં હરખા પટેલ આવ્યા : 'લવિયા, જો તારા માટે હું વાડીનાં તાજાં રિંગણાં લાવ્યો છું.' અને લવિયાને તલપ જાગી! એ તરત રિંગણાં લઈને ઘરે દોડ્યો, પત્નીને કહ્યું : 'આજે બાર વાગે આવું ત્યારે રિંગણાંનું શાક તૈયાર રાખજે.' એટલું કહેતાં તો લવિયો પત્નીની વાત સાંભળ્યા વગર જ નીકળી ગયો. બપોરે જમવાટાણું થયું. રિંગણાંનાં સપનાં જોતો-જોતો લવિયો ઘરે આવ્યો. પણ ભાણામાં રિંગણાં જોયા નહીં. પત્ની કહે : 'તમે રિંગણાં લાવ્યા તે પહેલા દાળ પલાળી દીધી હતી. એટલે થયું કે, રિંગણાં કાલે કરશું.' ત્યાં તો લવિયો તાડુક્યો, નિર્દોષ પત્નીને ન બોલવાનાં વેણ કઠ્ઠા : 'આના કરતા તો તું ફૂવામાં ફૂદીને મરી કેમ ન ગઈ...' થાળી ઉછાળી, મોઢું બગાડી, લવિયો જતો રહ્યો. મનોમન જેમ-તેમ બબડતો લવિયો દુકાને આવ્યો. હજી તો સંચે બેઠો ન બેઠો ત્યાં તો કોઈક દોડતું આવ્યું : 'લવિયા તારી પત્નીએ તો ફૂવામાં ઝંપલાવ્યું છે...' સમાચાર સાંભળી હેબતાઈ ગયેલા

લવિયો દોડ્યો તો ખરો, પણ આખરે ન થવાનું થઈ ગયું. લવિયાએ બેય રીતે બગાડ્યું - કઠોર વાણીથી અને અયોગ્ય વર્તનથી. જો તેણે ૨૪ કલાક રાહ જોઈ હોત તો આખી જિંદગી પસ્તાવાનું ન રહેત! બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ અને તેમના ગુરુ યોગીજી મહારાજ ઘણી વાર આ દૈષ્ટાંત આપતા. આપણે પણ થોડું તપાસવા જેવું તો ખરું. ક્યાંક મારા પરિવારજનો સાથેનો મારો સંબંધ આવો તો નથી ને? રોજબરોજના મારા સાહજિક વાણી-વર્તન, મારા સ્વજનોને પીડાદાયક તો નથી બનતા ને? 'બીજાના ભલામાં આપણું ભલું; બીજાના સુખમાં આપણું સુખ' એ જ જેમની જીવનભાવના રહી છે. જેમણે જીવનભર કોઈને દુભવ્યા નથી એવા વિરલ સંત પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના જીવનને જોતાં આપણને વાણી-વર્તન વ્યવહાર વિષયક સુંદર પ્રેરણા મળે એવી છે. સન્ ૧૯૮૫માં લંડન મુકામે બી.એ.પી. એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા 'કલ્ચરલ કેસ્ટીવલ ઓફ ઈન્ડિયા'નું અયોજન થયું હતું. આકર્ષક 'સ્વામિનારાયણ નગર'માં ભવ્ય ભારતની ઓળખ આપતા કાર્યક્રમો રોજ-રોજ

અંગ્રેજ પ્રજાને આશ્ચર્ય પમાડતા હતા. આ ઉત્સવ નિમિત્તે પ્રમુખસ્વામી મહારાજ પણ લંડનમાં જ રોકાયેલા અને પ્રતાપસિંહ પરમાર નામક યુવક તેઓને પોતાની ગાડીમાં બેસાડીને ઉતારેથી ઉત્સવ-સ્થળે લઈ જવાની સેવા કરતો હતો. તારીખ ૧-૮-૧૯૮૫ના રોજ પ્રમુખસ્વામી મહારાજ ભોજન લેવા બિરાજ્યા, ત્યારે નિત્યક્રમ મુજબ હરિભક્તો પણ તેઓ સાથે જમવા બેઠા. પણ તેમાં પ્રતાપસિંહ દેખાયા નહીં. તેથી પ્રમુખસ્વામીજીએ તેઓને ફોન કરાવ્યો : 'બાપુ! તમારી રાહ જોઈ છે. જમવાનું અહીં રાખ્યું છે, તમે આવો પછી સાથે જમીએ.' બપોરે ૧૨:૪૦ વાગ્યે આ ફોન કર્યા પછી તેઓએ ૨:૪૦ વાગ્યા સુધી રાહ જોઈ! છતાં જ્યારે પ્રતાપસિંહ ન આવ્યા અને ફરી ફોન કરાવ્યો ત્યારે પ્રતાપસિંહે કહ્યું : 'બાપુ! આજે હું મોડો પરવારીશ એમ લાગે છે. માટે આપ જમી લો!' પ્રતાપસિંહની આ વિનંતી સાંભળ્યા બાદ જ પ્રમુખસ્વામી મહારાજે ભોજન આરોગ્યું!!! આમ જોવા જઈએ તો ક્યાં પ્રમુખસ્વામી મહારાજ - લાખોના ગુરુ અને વિશાળ સંસ્થાના પ્રમુખ; અને ક્યાં એમની સંસ્થામાં સેવા

કરતા એક સામાન્ય સ્વયંસેવક! છતાં જેને કારણે એમને જમવામાં બે કલાક મોડું થયું તે સ્વયંસેવકને તેઓએ કોઈ વેણ તો ન માર્યા પણ તેમને પોતાના જાણીને કેવી પ્રેમસંભાળ લીધી! આપણા મુખેથી સરેલા પ્રેમના બે બોલ - 'તમારી રાહ જોઈ છું...' એ સાંભળનારને કેવા લાગણીશીલ કરી દે? આપણે કોઈક માટે રાહ જોઈને, બે કલાક સુધી ન જમીએ એ વર્તન સામેવાળી વ્યક્તિને કેવી વશ કરી દે? વધુ નહીં તો કાંઈ નહીં પણ આપણા પરિવારજનો સાથે તો આવા પ્રેમભર્યા વાણી-વાર્તન રાખીએ! આપણા સ્વજનને માટે થોડું સહન કરવું પડે તો ખુશીથી કરીએ! પ્રમુખસ્વામી મહારાજ કહે છે : 'બોલવામાં સંયમ આવી જાય તો અડધું કામ થઈ જાય. માટે વાણી સુધારવી, બોલવામાં શાંતિ રાખવી. નમી જવું. સામે ગરમ થાય તો આપણે નરમ થવું. વાણીદોષને લીધે મોટા ઝઘડા થઈ જાય છે.' વાણી વધા સિવાય કે વર્તન વર્ત્યા સિવાય આપણે ક્યારેય જીવી નથી શકવાના; તો ચાલો આજે આપણને થયેલાં આ વિશિષ્ટ 'પ્રમુખદર્શન'ને આધારે - 'કોઈ કહે ત્યારે નમી જઈને' વાણીમાં અને 'સામે ગરમ થાય ત્યારે આપણે નરમ થઈને' વર્તનમાં પ્રેમનું ઘટક ઉમેરી દઈએ. પ્રમુખસ્વામીના પગલે-પગલે આપણા પરિવારને કંકાસ-ઝઘડાથી મુક્ત અને પ્રેમ-આનંદથી યુક્ત કરી દઈએ... જેથી આપણે પણ 'લવિયા'ની જેમ જીવનભર પસ્તાવું ન પડે...

- સાધુ વેદકીર્તિદાસ



રંગારંગ કાર્યક્રમ સાથે કોમનવેલ્થ ગેમ્સનો પ્રારંભ



બર્મિંગહામ : વિશ્વના ૭૨ દેશના પાંચ હજાર એથલેટ્સ બર્મિંગહામ પહોંચી ચૂક્યા છે અને ઈંગ્લેન્ડના મુખ્ય બિઝનેસ સિટીમાં સ્થાન પામેલા બર્મિંગહામમાં ગુરુવારે રાત્રે ૧૧.૩૦ કલાકે રંગારંગ કાર્યક્રમ દ્વારા કોમનવેલ્થ ગેમ્સનું ઉદ્ઘાટન થયું હતું. આ ગેમ્સનું મુખ્ય કેન્દ્ર એલેક્ઝાન્ડર સ્ટેડિયમ છે જેમાં ઓપનિંગ સેરિમની યોજાઈ હતી અને આ સ્ટેડિયમમાં એથલેટિક્સની મોટા ભાગની ઇવેન્ટ યોજાવાની છે. સ્ટેડિયમમાં લગભગ ૩૦ હજાર લોકો હાજર રહ્યા હતા. બ્રિટિશ પરંપરા મુજબ પ્રત્યેક ગેમ્સનું ઉદ્ઘાટન બ્રિટનની મહારાણી એલિઝાબેથ કરે છે પરંતુ સંભવિત સ્વાસ્થ્યના કારણોસર ગેમ્સનું ઉદ્ઘાટન તેમના પુત્ર પ્રિન્સ ચાર્લ્સ દ્વારા કરવામાં આવ્યું હતું. ગેમ્સની બેટન રિલેને પણ પ્રિન્સ ચાર્લ્સ લીલી ઝંડી આપી હતી. ચાર્લ્સે મહારાણીના ભાષણને વાંચીને ગેમ્સને

ખુલ્લી મૂકવાની જાહેરાત કરી હતી. બર્મિંગહામને ઈંગ્લેન્ડના સૌથી વધારે વિવિધ સંસ્કૃતિઓ ધરાવતા શહેરમાં સ્થાન મળ્યું છે અને કાર્યક્રમમાં પણ તેની ઝલક જોવા મળી હતી. બર્મિંગહામના જાણીતા બ્રિટિશ રોક બેન્ડ ડયૂરને ડયૂરને પોતાના હિટ સોંગ્સ દ્વારા સમર્થકોને ભરપૂર મનોરંજન પુરું પાડ્યું હતું. આ બેન્ડ ઉપરાંત ૧૯૭૦ના દશકાના સુપરહિટ બ્રિટિશ બેન્ડ બ્લેક સાબાથના લીડ ગિટારિસ્ટ રહેલા ટોન ઈયોમીએ પણ પોતાના સંગીતનો જાદુ પાચ્યો હતો. કાર્યક્રમના અંત ભાગમાં ૭૨ દેશના ખેલાડીઓની પરેડ થઈ હતી અને તેની શરૂઆત ૨૦૧૮ની કોમનવેલ્થના યજમાન ઓસ્ટ્રેલિયા સાથે થઈ હતી. પીવી સિંધુ એને હોકી પ્લેયર મનપ્રીતસિંહ ભારતના ધ્વજવાહક બન્યા હતા. ભારતના નામની જાહેરાત થઈ ત્યારે સ્ટેડિયમમાં ઉત્સાહ છવાઈ ગયો હતો.

ભારતે ૩૯ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત વિન્ડીઝને તેની જ ધરતી ઉપર ક્લીનસ્વીપ કરી

વિજયની હેટ્રિક સાથે ભારતે વેસ્ટ ઇન્ડિઝને ૩-૦થી વ્હાઈટવોશ કર્યો

પોર્ટ ઓફ સ્પેન

વરસાદના વિદ્ય વચ્ચે ૩૬૪૯ લૂઈસ નિયમના આધારે ભારતે અહીં રમાયેલી ત્રીજી અને અંતિમ વન-ડેમાં યજમાન વેસ્ટ ઇન્ડિઝને ૧૧૯ રનથી હરાવીને ત્રણ મેચની શ્રેણીમાં ૩-૦થી યજમાન ટીમને વ્હાઈટવોશ કર્યો હતો. ભારતીય સુકાની ધવન ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને ઇનિંગ દરમિયાન બે વખત વરસાદનું વિદ્ય નડ્યું હતું. ૩૬ ઓવરમાં ભારતે ત્રણ વિકેટ ૨૨૫ રન બનાવ્યા હતા. ત્યારબાદ વેસ્ટ ઇન્ડિઝને ૩૬૪૯ લૂઈસ નિયમના આધારે ૩૫ ઓવરમાં ૨૫૭ રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. વિન્ડીઝની ટીમે ૨૬ ઓવરમાં ૧૩૭ રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ



શુભમન ગિલ પ્લેયર ઓફ ધ સિરીઝ બન્યો

ત્રીજો બેટ્સમેન બન્યો છે. આ પહેલાં ૨૦૦૧માં સમીર દિથે વિન્ડીઝ સામે ૯૪ તથા હાર્દિક પંડ્યા ૨૦૨૦માં ઓસ્ટ્રેલિયા સામે ૯૨ રનના સ્કોરે અણનમ રહ્યો હતો.

વેસ્ટ ઇન્ડિઝ સામે વન-ડેમાં એક હજાર રન પૂરા કરનાર શિખર ધવન અને ગિલે પ્રથમ વિકેટ માટે ૧૧૩ રનની ભાગીદારી નોંધાવીને ભારતની ઇનિંગનો શાનદાર પ્રારંભ કર્યો હતો. ધવન ૭૪ બોલમાં ૫૮ તથા શ્રોયસ ઐયરે ૩૪ બોલમાં ૪૪ રન બનાવ્યા હતા. હેડન વોલ્શે ૫૭ રનમાં બે વિકેટ હાંસલ કરી હતી. રનચેઝ કરનાર વિન્ડીઝ ટીમ માટે ઓપનર બ્રેન્ડન કિંગ (૪૨) તથા નિકોલસ પૂરને (૪૨) ઉપયોગી રન બનાવ્યા હતા.

વિમેન્સ ટી-૨૦ રેન્કિંગમાં મંધાના અને શેફાલી ટોપ-પાંચમાં યથાવત્

મેગ લેનિંગ ૭૩૧ પોઈન્ટ સાથે વિશ્વની નંબર-૧ ટી૨૦ બેટ્સવુમન

દુબઈ

આઈસીસીની વિમેન્સ ટી૨૦ રેન્કિંગમાં ભારતની સ્મૃતિ મંધાના અને શેફાલી વર્મા ટોપ-પાંચમાં જળવાઈ રહી છે. મંધાના ૬૮૧ પોઈન્ટ સાથે ચોથા તથા શેફાલી ૬૭૯ રેટિંગ પોઈન્ટ સાથે પાંચમા ક્રમે છે. આ બંને સિવાય ટોપ-૧૦ બેટ્સવુમનમાં એક પણ ભારતીય ખેલાડી નથી. બીજી તરફ ઓસ્ટ્રેલિયાની સિનિયર ખેલાડી મેગ લેનિંગે પોતાના જ દેશની અન્ય ખેલાડી બેથ મૂનીના નંબર-૧ના તાજને છીનવી લીધો છે. પાકિસ્તાન અને આયરલેન્ડ સામે શાનદાર પ્રદર્શન કરનાર લેનિંગ હવે ૭૩૧ પોઈન્ટ સાથે વિશ્વની નંબર-૧ ટી૨૦ બેટ્સવુમન બની

ગઈ છે. બેથ મૂની બીજા ક્રમે સરકી ગઈ છે. તેના લેનિંગ કરતાં ત્રણ પોઈન્ટ ઓછા છે. આયરલેન્ડ સામે બે ઇનિંગ્સમાં લેનિંગે ૧૧૩ રન બનાવ્યા હતા. જેની સામે બેથ મૂની કુલ નવ રન જ બનાવી શકી હતી. ઓસ્ટ્રેલિયાની તાહલિયા મેકગ્રા ૧૫ ક્રમાંકની આગેકૂચ કરીને ૧૩મા ક્રમે પહોંચી ગઈ છે. સાઉથ આફ્રિકાની ત્રણ ખેલાડી લૌરા વોલ્વાર્ડ (૧૪મા), એની બોશ (૨૧મા) અને તાજમિન બિટ્સે (૨૪મા) ઈંગ્લેન્ડ સામે નિરાશાજનક પ્રદર્શન કર્યું હોવા છતાં બેટ્સવુમની યાદીમાં આગેકૂચ કરી છે. બોલર્સમાં ઈંગ્લેન્ડની સોફી એક્લેસ્ટોન ૭૬૭ રેટિંગ પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને જળવાઈ રહી છે.



ભારત ૨૦૨૫ના વિમેન્સ વર્લ્ડ કપની યજમાની ફરશે

બર્મિંગહામ : આઈસીસીએ ૨૦૨૪થી ૨૦૨૭ની વચ્ચે રમાનારી વિમેન્સ ક્રિકેટ ટૂર્નામેન્ટના યજમાન દેશની જાહેરાત કરી દીધી છે. આ ગાળામાં ચાર મેજર ઇવેન્ટ રમાશે. ભારત ૨૦૨૫ના વિમેન્સ વન-ડે વર્લ્ડ કપની યજમાની ફરશે. ભારત ૨૦૧૩માં પણ વિમેન્સ વર્લ્ડ કપની યજમાની કરી ચૂક્યું છે. આગામી ટૂર્નામેન્ટમાં આઠ ટીમો ભાગ લેશે અને કુલ ૩૧ મેચ રમાશે. બર્મિંગહામ ખાતે યોજાયેલી આઈસીસીની વાર્ષિક સામાન્ય સભામાં આ નિર્ણય લેવાયા હતા.

૨૦૨૪નો વિમેન્સ ટી૨૦ વર્લ્ડ કપ બાંગ્લાદેશમાં થશે. આ પહેલાં ૨૦૧૪માં વિમેન્સ તથા મેન્સ ટી૨૦ વર્લ્ડ કપ બાંગ્લાદેશમાં રમાયો હતો. આ ઇવેન્ટનું આયોજન સપ્ટેમ્બર ઓક્ટોબરમાં થશે જેમાં ૧૦

ટીમો વચ્ચે કુલ ૨૩ મુકાબલા રમાશે. ઓસ્ટ્રેલિયા મેન્સ તથા વિમેન્સ બંનેના વન-ડે વર્લ્ડ કપમાં ચેમ્પિયન છે. ઈંગ્લેન્ડને પણ ૨૦૨૬ના વિમેન્સ ટી૨૦ વર્લ્ડ કપની યજમાની મળી છે. ટૂર્નામેન્ટની સંખ્યા ૧૦થી વધારીને ૧૨ કરવામાં આવી છે અને કુલ ૩૩ મેચ રમાશે. આ ટૂર્નામેન્ટનું આયોજન જૂન મહિનામાં થશે. પ્રથમ વિમેન્સ ટી૨૦ વર્લ્ડ કપ ઈંગ્લેન્ડમાં જ રમાયો હતો. આ ઉપરાંત વિમેન્સ ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન થશે પરંતુ આ ટૂર્નામેન્ટ ટી૨૦ ફોર્મેટ મુજબ રહેશે. આ ઇવેન્ટની યજમાની શ્રીલંકાને મળી છે પરંતુ તેની ટીમ ટૂર્નામેન્ટ માટે ક્યોવિકાસ થાય તો જ યજમાની મળે તેવી શરત પણ રાખવામાં આવી છે. ૨૦૨૬માં રમાનારી આ ઇવેન્ટમાં છ ટીમો વચ્ચે ૧૬ મુકાબલા રમાશે.

SHIV FINANCIAL SERVICES

Serving Community Since 2009
Canada

BEST RATES AVAILABLE

FREE PERSONAL TAX-FILE FOR NEW IMMIGRANTS

SUPER VISA MEDICAL INSURANCE & VISITOR TO CANADA MEDICAL INSURANCE

JAGDISHBHAI SEVAK
Insurance Broker

647-236-7620
sevak_2007@hotmail.com • www.shivfinancialservices.ca
"PROPER INSURANCE COVERAGE IS PEACE OF MIND"

કર્મચારીની અછત નહીં સર્જાય તે માટે ઈમિગ્રેશન પર વધુ નિયંત્રણ આવશ્યક

કેનેડાના અનેક પ્રાંતીય ઈમિગ્રેશન અધિકારીઓએ ફેડરલ સમકક્ષને પત્ર મોકલ્યો

ટોરન્ટો

રાષ્ટ્રવ્યાપી મજૂરની અછતને ટાંકીને, ઘણા પ્રાંતીય ઈમિગ્રેશન અધિકારીઓ કહે છે કે તેઓ ઈમિગ્રેશન પ્રક્રિયા પર વધુ નિયંત્રણ ઇચ્છે છે અને તેઓએ તેમના ફેડરલ સમકક્ષને પત્ર મોકલ્યો છે, જેમાં પરિવર્તનની હાકલ કરવામાં આવી છે.

ઓન્ટેરિયો, આલબર્ટા, સાસ્કાચેવન અને મેનિટોબાના મંત્રીઓ કેનેડાના ઈમિગ્રેશન, શરણાર્થીઓ અને નાગરિકતા મંત્રી સીન ફેડરને

મંગળવારે રાત્રે મોકલેલા પત્રમાં તેમના પરંપરાગત સૌથી વધુ જરૂરી કુશળતા સાથે વધુ ઈમિગ્રેશન પસંદ કરવાની મંજૂરી આપવા માટે બોલાવી રહ્યા છે. પત્રમાં જણાવ્યું છે કે, અમને ચોક્કસ વિસ્તારો અને સમુદાયોની ઝડપથી વિકસતી જરૂરિયાતોને પ્રતિસાદ આપવાની ક્ષમતાની જરૂર છે.”

સેન્ટ જહોન, એન.બી.માં ફેડરલ અને તેમના સાથી ઈમિગ્રેશન મંત્રીઓ સાથેની બેઠક પહેલાં, તેમણે કહ્યું કે

કેનેડાને કામદારોને આકર્ષવા અને જાળવી રાખવા માટે વધુ કામ કરવાની જરૂર છે. તેઓ કહે છે કે પરંપરાગત કામદારોની ભરતી કરવાની અને તેમને સારી સ્થાનિક નોકરીઓ ઓફર કરવાની મંજૂરી આપવી જોઈએ.

પત્રમાં કહેવામાં આવ્યું છે કે વિવિધ પરંપરાગત સ્થાનિક અર્થવ્યવસ્થાને સારી રીતે જાણે છે અને કેનેડામાં નવા આવનારાઓને પસંદ કરી શકે છે જેમની પાસે સફળતાની સૌથી મોટી તક છે.

ઓસ્ટ્રેલિયામાં સેમસંગને વોટર પ્રૂફની ખોટી જાહેરાત બદલ 7808 કરોડનો દંડ

કેનબેરા

ઓસ્ટ્રેલિયાની કોર્ટે સેમસંગને રૂ. ૭૮૦૮ કરોડનો દંડ ફટકાર્યો છે. કંપનીએ સ્માર્ટફોન વોટરપ્રૂફ છે એવી ખોટી જાહેરાતો કરી હતી, એ જાહેરાતો અંગે તપાસ થતાં એમાં કોઈ તથ્ય ન હોવાનું જણાતા આ દંડ ફટકારાયો હતો. એટલું જ નહીં, તપાસ એજન્સીને ખર્ચ પેટે અલગથી દોઢ લાખ ડોલર આપવાનો આદેશ પણ કોર્ટે કર્યો હતો.

સાઉથ કોરિયાની કંપની સેમસંગે ઓસ્ટ્રેલિયામાં ૨૦૧૬થી ૨૦૧૮ દરમિયાન સેમસંગના સાત મોડલ વોટરપ્રૂફ હોવાની જાહેરાતો કરી હતી. એમાંના ઘણાં મોડેલ વોટરપ્રૂફ નથી એવી ફરિયાદો ઉઠી હતી. એ

પછી ચારેક વર્ષ પહેલાં ઓસ્ટ્રેલિયન કન્ઝ્યુમર કોમ્પિટિશન કમિશને કંપનીના દાવા બાબતે તપાસ શરૂ કરી હતી. તપાસમાં જણાયું હતું કે કંપનીનો દાવો ભૂલભરેલો છે અને લોકોને ગેરમાર્ગે દોરે છે. ઓસ્ટ્રેલિયામાં લગભગ ૩૧ લાખ જેટલાં સ્માર્ટફોન વેચનારી સેમસંગ કંપની સામે કેસ દાખલ થયો હતો. કોર્ટે ખૂબ જ મહત્વપૂર્ણ ચુકાદો આપતા કંપનીને ૮૮ લાખ ડોલરનો માતબર દંડ ફટકાર્યો હતો. એ સિવાય ઓસ્ટ્રેલિયન કન્ઝ્યુમર કોમ્પિટિશન કમિશનને તપાસ દરમિયાન જે ખર્ચ થયો તેના વળતર પેટે દોઢ લાખ ડોલર આપવાનો આદેશ પણ કર્યો છે.

બાંગ્લાદેશે આંતરરાષ્ટ્રીય નામા ભંડોળ પાસે 4.5 અરબ ડોલરની લોન માગી

ટાકા

બાંગ્લાદેશમાં આર્થિક પરિસ્થિતિ બગડતી જઈ રહી છે. બાંગ્લાદેશે IMF પાસે 4.5 અરબ ડોલરની લોન માગી છે. આ સંબંધિત બાંગ્લાદેશના નાણાકીય મંત્રી એએચએમ મુસ્તફા કમાલે આઈએમએફને સત્તાકીય રીતે પત્ર લખ્યો છે. રિપોર્ટ અનુસાર આઈએમએફના મેનેજિંગ ડાયરેક્ટર ક્રિસ્ટાલિના જોજીવાને લખેલા આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે દેશની આર્થિક હાલત વચ્ચે વિદેશી વિનિમય અનામતને સ્થિર રાખવા અને બાંગ્લાદેશ પર ક્લાઈમેટ ચેન્જના પ્રભાવોને ઓછા કરવા માટે લોન લેવાની જરૂર છે.

ઈરાનના રણમાં પૂર : 22 લોકોના મોત



ઈરાનના દક્ષિણી પ્રાંત ફાર્સમાં અચાનક પૂર આવવાને કારણે લગભગ 22 લોકોના મોત થઈ ચૂક્યા છે. શહેરમાંથી વહેતી રૂબરૂ નદીનું જળસ્તર ભારે વરસાદને કારણે નોંધપાત્ર રીતે વધી ગયું છે. 22 લોકોના મોત થયા છે જ્યારે રેસ્ક્યુ ટીમે 55 લોકોને બચાવી લીધા છે. હજુ પણ 10થી 20 લોકો લાપતા છે.

પાક. દ્વારા બાંગ્લાદેશના ધ્વજના કરાયેલા અપમાન બાદ ઢાકામાં વ્યાપક વિરોધ

ટાકા

બાંગ્લાદેશના રાષ્ટ્ર ધ્વજનું અહીંના પાકિસ્તાનના હાઈકમિશને કરેલા અપમાન માટે ઢાકામાં પાક. હાઈ કમિશન સમક્ષ વ્યાપક દેખાવો યોજવામાં આવ્યા હતા. લોકોએ બેનરો લઈ પાક. હાઈકમિશન સામે જોરદાર નારા લગાવ્યા હતા. વાત એમ બની હતી કે પાકિસ્તાન હાઈકમિશન દ્વારા સોશયલ મીડીયા ઉપર બાંગ્લાદેશના રાષ્ટ્ર ધ્વજની જે તસ્વીર દર્શાવવામાં આવી હતી તેમાં બાંગ્લાદેશના ધ્વજની સાથે પાકિસ્તાનના ધ્વજમાં રહેલા ‘ચાંદ-તારા’ને પણ દર્શાવવામાં આવ્યા હતા. તેમાંથી આ વિવાદ શરૂ થઈ ગયો હતો.

માત્ર ગરવી ગુજરાત કે મેરા ભારત મહાન જ નહિ પરંતુ સમગ્ર વિશ્વની અટરીએ સર્જતી અનેકવિધ ઘટનાઓનો સાક્ષાત્કાર ક્ષણેક્ષણ માણો !!

રાજકારણ, સમાજ, ધર્મ, શિક્ષણ, રમતગમત, મનોરંજનનો મહાસાગર, હોલીવુડ-બોલીવુડ, પ્રવાસ-પર્યટન, પર્યાવરણ તથા આરોગ્ય વિષયક માહિતીના રોમાંચક ખજાનાનો આવિષ્કાર !!

www.swadesh.news

સ્વદેશમાં વિજ્ઞાપનો માટે ઈમેલ એડ્રેસ પર માહિતી મોકલો

info@swadesh.news



હવે **APP STORE** તથા **PLAY STORE** પરથી

SWADESH NEWS

ઢાઈપ કરી મોબાઈલ એપ્સ તમારા ફોન પર **INSTALLED** કરી ઘરે બેઠા બેઠા કોરોના તથા દેશ-દુનિયાનાં સમાચારો વાંચો.

**CLUB
CERAMIC****Porcelain Tiles : Premium Quality and Best Price**

- ◆ Porcelain & Ceramic tiles at Direct factory price
- ◆ Price match guarantee + we will beat price with additional 5% discount
- ◆ Tiles available for Floor, Wall and Outdoor Parking

**TILES • BACKSPLASH • LAMINATE • VINYL • HARDWOOD****MONTREAL**3590, Rue Griffith, Saint Laurent,
QC, H4T 1A7
Phone: +1-514-260-2242 /
+1-514-813-3850**OTTAWA**Unit #4+5, 200
Colonnade Road,
Nepean, ON, K2E 7M1
+1-613-601-1474**MISSISSAUGA**5030 Maingate Drive, Unit#1,
Mississauga, L4W 1X5
Phone: +1 (647) 527-6030 /
+1-514-813-3850**CAMBRIDGE**15 Sheldon Dr, Cambridge,
ON N1R 6R8
+1-647-542-1508 ,
+1-647-527-6030<https://clubceramic.com> Email : sales@clubceramic.com**PANCHVATI SUPERMARKET**
www.panchvatisupermarket.ca**OPENING SOON
OSHAWA**1053 Simcoe Steet North
Oshawa L1G 4X1રક્ષાબંધન નિમિત્તે રાખડી,
મીઠાઈઓ, ગીફ્ટ બોક્સ
તેમજ પૂજની સામગ્રી મળશે
તો આજે જ લાભ ઉઠાવોસર્વે ભાઈ
અને બહેનોને
રક્ષાબંધનની
શુભકામના**MISSISSAUGA**169 Dundas St. E,
Unit# 1 to 4, Mississauga,
ON L5A 1W8
Call : 905-232-3955**BRAMPTON**8814 The Gore Road,
Unit 4-8, Brampton,
ON L6P 0B1
Call : 905-794-5372**SCARBOROUGH**2141 Ellesmere Road,
Behind Scotia Bank
Scarborough, ON M1G 3M6
Call : 416-439-9393**ETOBICOKE**3-45 Woodbine Downs Blvd,
Etobicoke,
ON M9W 6N5
Call : 416-213-9394**AJAX**18, Harwood Ave.
South, Ajax,
ON L1S 6N2
Call : 905 426 2499**SCARBOROUGH**

1255 Markham Rd, Scarborough, ON M1H 2Z5 • Call : 416-289-6988